

પ્રસ્તાવના:

ઇન્ટરનેટ સાઇટ પર પ્રગતિશીલ જૂથ ફોરમમાં (<http://dawoodi-bohras.com/forum/viewtopic.php?f=1&t=10469>) એક હકનીવાત (ગુપ્ત નામ) એ સૈફીમહલ ની અને તેના રહેવાસી ની ઘણી બધી અંદરની વાતો - જે અપણે ક્યારે પણ સાંભળી નથી - તે લખી છે. આ વાતો અંગ્રેજી ભાષામાં લખવામાં આવી છે. જે મુંમેનીનો અંગ્રેજી ભાષા સમજી શકતા નથી તેઓના લાભ માટે ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યો છે. આ અનુવાદમાં ઘણી બધી જોડણી અને વ્યાકરણ ની ભુલો હશે તે દરગુજર કરશો. આ અનુવાદનો ખાસ મકશદ દરેક મુમેનીન સુધી આ અંદરની વાતો પહોંચે અને દરેકને જાણ થાય કે અપણી કોમમાં શું થયું છે અને શું થઈ રહ્યું છે.

લેખ ૧ - સૈફી મહલ નો ઇતિહાસ - કહેવું જરૂરી છે

લેખ ૨ - ઘટના મુંબઇના મુંમેનીન વિરુદ્ધ

લેખ ૩ - બધાને એક કતાર માં લાવો

લેખ ૪ - તમે મારા ભાઈ નથી:

લેખ ૫ - સંક્ષિપ્ત હેવાલ મુલતકાનો

લેખ ૬ - બુરહાનુદ્દીન મૌલાને બાજુ પર મુંક્યા

લેખ ૭ - મુફ્ફદલ ભાઇસાહેબ શરૂથી કાળજીપૂર્વક પસંદ કરવામાં આવેલા:

લેખ ૮ - બુરહાનુદ્દીન મૌલાનો (રા) વારસો:

લેખ ૯ - અમાલત કે ધબડકો

લેખ ૧૦ - ધર્મ રક્ષક

લેખ ૧૧ - બુરહાનુદ્દીન મૌલાના મોઝીઝા

લેખ ૧૨ - એક રોકાણ અવળી દિશામાં

લેખ ૧૩ - મુનાફિક શહેઝાદા

લેખ ૧૪ - કાઇદઝોહર ભાઇસાહેબના દીકરાનો નાશ

લેખ ૧૫ - બુરહાની મંઝીલમાં એક વધું ભોગ

લેખ ૧૬ - તમે તેમને હરાવી નથી શકતા, તેમના સાથે જોડાઈ જાવ

લેખ ૧૭ - મુફ્ફદલ ભાઇસાહેબના ઉગ્ર વ્યવહારનો એક વધું ભોગ

સવાલ જવાબો.

સૈફી મહલ ની અંદર ની વાતો.

સૈફી મહલ નો ઇતિહાસ - કહેવું જરૂરી છે: લેખ ૧ તા.૧૪/૧૨/૨૦૧૪

આફિકાની ઘટના થયા પછી, એસ.કે.ક્યું ના માતૃ પરિવારે એમના સાથેના વહેવાર તોડી નાંખ્યા. પરંતુ રસપ્રદ વાત એ છે કે આજ કુટુંબીઓ આ પહેલા તેમને ઉપર ઊઠાવવામાં થઈ

શકે એવા બધાજ પ્રયાસ કરવા માટે જવાબદાર છે, આ પરિવારના સભ્યો તેમને તેઓ એસ.એમ.બી. કરતાં પણ વધુ મહત્વ આપતા હતા તે સ્પષ્ટ પણે દેખાતુ હતુ. આ વર્તણૂક શરૂઆતમાં એસ.કે.ક્યું ને નીચે લાવવા માટે પાચો નાખ્યો છે.

એસ.એમ.બી. ના વફાત પછી, ઇદરીસ ભાઈસાહેબ ની આગેવાની હેથલ સૈફી મહલ માં દૈનિક બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં, એસ.કે.ક્યું ના વિવિધ પરિવારના સભ્યો દ્વારા એસ.કે.ક્યું. માટે અયોગ્ય ભાષા નો પ્રયોગ કરવામાં આવ્યો. એક માતૃપક્ષની બહેને તો ખરેખર એમ તહોમત લગાવી કે એસ.કે.ક્યું ના નજીકના કુટુંબીઓ તેના અને તેના બાલકો પ્રત્યે કઠોર વ્યવહાર રાખે છે. આજ તહોમત બીજા માતૃપક્ષી સગાઓ ત્યાં તેમના બાલકો એ લગાવી.(આ લોકો એસ.ટી.એસ. નાચોથા પત્ની આમેના આઈસાહેબાના ફરજંદો છે). ખાસ કરીને આમેના આઈસાહેબાના પૌત્ર, પૌત્રીઓ એસ.કે.ક્યું ના વરસોથી સખત વિરોધી રહ્યા છે. તેઓ ની ફરિયાદ છે કે એસ.કે.ક્યું ના બાળકો દ્વારા તેમનો અનાદર થાય છે અને તેથી તેઓ સંપૂર્ણપણે તેઓ ના વચ્ચેનો સંબંધ તોડી નાખવામાં માને છે.

હવે જ્યારે એસ.કે.ક્યું ના તરફેણમાં અને વિરોધમાં ચળવળની શરૂઆત આમેના આઈસાહેબાના કુટુંબીજનો સાથે શરૂ થઈ, એસ.કે.ક્યું ના બાલકો જુદા પડતા ગયા અને તેથી કોટુંબીક પ્રવૃત્તિઓ એસ.એમ.બી. સાથે તથા સૈફી મહલના બીજા ઓ સાથે લગભગ શૂન્ય થઈ ગઈ. આ સ્વ - અલગતાવાદી પણાથી આખરે સૈફી મહલના બાકીના ઓ ખરેખર તેમને દૂર રાખતા થઈ ગયા અને બુરા નામથી બોલાવવું, મશ્કરી કરવી વગેરે બધાજ પ્રશંગોએ બધીજ રીતે સતાવ્યા. આજ અરસામાં બાકીના કસરે આલીના સભ્યો એ(એસ.એમ.બી. ના કુટુંબીજનો અને એસ.ટી.એસ. ના ફરજંદો) માઝુનના રૂતબાને નીચો બનાવવા એક ઝુંબેશ ચલાવી, આ ઠણ-મશ્કરી, હાંસીમજાક એ હદ સુધી લઈ જવામાં આવી કે પછી એમના પહેરવેશ વગેરે ઉપર પણ દોષારોપણ કરવા લાગ્યાં.

આમ આજે આપણે જે જોઈ રહ્યા છે એ વિભાજન નો પાચો નંખાચો. આજ સમય દરમિયાન એસ.એમ.બી. ના શહેજાદા બળવાન બનતા ગયા અને લોકોની આખોમાં ખુદા જેવા - ખાસ કરીને મુફ્ફદલ ભાઈસાહેબ. એજ અરસામાં એસ.કે.ક્યું ના ફરજંદો વિરુદ્ધ થતા ગયા.જ્યારે આ ચલવલ સૈફી મહલ અને એસ.કે.ક્યું ના ફરજંદો વચ્ચે વધુ શક્તિશાળી બની, જ્યારે અજીજ ભાઈસાહેબે ઊમેઈમાં બાઈસાહેબ (મુફ્ફદલ ભાઈસાહેબ ના દીકરી)સાથે શાદી કરવા નો સુરતમાં ઇનકાર કરી દિધો. આ પ્રસંગ ને કાસીમ ભાઈસાહેબ ની આગેવાની હેથલ દ્વેષપૂર્ણ ઝુંબેશ એમ કહીને શરૂ કરવામાં આવી કે એસ.કે.ક્યું મૌલા સાથે નથી અને મૌલાની ખુશી વિરુદ્ધ જઈ રહ્યાં

છે. આ સુરતમાં બનેલા પ્રસંગ પછી માઝુન સાહેબના વિરુદ્ધ જગજાહેર ઝુંબેશની શરૂઆત થઈ. આ ઝુંબેશમાં એમ પણ સામીલ કરવામાં આવ્યું કે એસ.કે.ક્યું અને તેના ફરજંદો તેના ભાષણોમાં એસ.એમ.બી. વિષે ઘણો કમ ઉલ્લેખ કરે છે.

ફરી પાછા આજના સમય માં આવીએ તો, એસ.કે.ક્યું ના ફરજંદો કઠિન લડાઈ લડી રહ્યા છે – જે તેમની ઉપર જણાવેલ ગ્રહણશકિત થી દેખાઈ આવે છે. આમ એક અસ્વીકાર્ય વ્યક્તિ થી શેહઝાદા થવું અને તે પણ ટુંકમાં એ એક ભયાવહ કાર્ય છે. તેથી સૈફી મહલમાં, ના કે ફકત નિચે ઊતારી પાડવામાં આવેલા એસ.કે.ક્યું માટે સક્ય એવો ટેકો મેલવવો અસંભવ છે, પરંતુ એસ.કે.ક્યું ના ફરજંદો ની સૂઝ અને તીવ્ર ક્રોધ એસ.કે.ક્યું ને પોતાને નીચે ઊતારી પાડ્યા છે, ખાસ કરીને જુવાન ભાઈસાહેબોની નજરમાં.

સૈફી મહલ ની અંદર ની વાતો.

ઘટના મુંબઈના મુંમેનીન વિરુદ્ધ: લેખ ૨ તા.૧૯/૧૨/૧૪

સૈયદના તાહેર સૈફુદ્દીન (ર.આ) ના વફાત બાદ, સૈયદના મૌહંમદ બુરહાનુદ્દીન (ર.આ) યે ઘણા વરસ અસરા મુંબઈમાં કર્યા. અને પછી એકાએક કંઈક બદલાવ શરૂ થયો. મુંબઈના મુંમેનીન વિરુદ્ધ યુસુફ ભાઈસાહેબ નજમુદ્દીન યે એક ઝુંબેશની શરૂઆત કરી. આ ઝુંબેશ મુકાશિર સાલેહ ભાઈસાહેબના વિરુદ્ધ પણ હતી. સાલેહ ભાઈસાહેબ, યુસુફ ભાઈસાહેબ નીસરખાવનીમાં ઘણા ઉદાર હતા. આ ફળ સ્વરૂપ યુસુફ ભાઈસાહેબે સૈયદના મૌહંમદ બુરહાનુદ્દીન (ર.આ) ના શેહઝાદા ઓ વચ્ચે સાલેહ ભાઈસાહેબના વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો. એજ ખુન્નસ થી જે સૈયદના કુંતબુદ્દીન ના માટે થઈ હતી, પણ થોડી નરમ સાલેહ ભાઈસાહેબ માટે. એમ દાવો કરવામાં આવ્યો કે સાલેહ ભાઈસાહેબ, મૌલાના મૌહંમદ બુરહાનુદ્દીનની ખુશી મુજબ કાર્ય કરતા નથી.

આ ઝુંબેશ સાલેહ ભાઈસાહેબ, -જેણા ઉપર લોકો ને ઉખાભરી લાગણી હતી- તે ઉપરાંત મુંબઈના મુંમેનીન વિરુદ્ધ પણ હતી. સીધેસીધું અને લોકોની વચ્ચે યુસુફ ભાઈસાહેબે દાવો કર્યો કે મુંબઈના મુંમેનીનો ના ઇખલાસમાં શંકા છે. એક વખત બુરહાનુદ્દીન મૌલા સુરતમાં હતા ત્યારે, યુસુફ ભાઈસાહેબના મુલતકા પહેલાં. યુસુફ ભાઈસાહેબ દાવો કર્યો કે બુરહાનુદ્દીન મૌલા મુંબઈના મુંમેનીન ઉપર ઘણા ખફા છે અને તેઓ માથી કોઈ સાથે વાત કરવા પણ તૈયાર નથી! સાલેહ ભાઈસાહેબ ઉપર જોરદાર દબાણ કરવામાં આવ્યું. તેઓને એમ કહેતા સાંભલવામાં આવેલા કે હું એ દિવસ ની મુશ્કેલથી રાહ જોઈ રહ્યો છું કે મને આ બધા લોકો થી દુર લઈ જવામાં આવે. (યુસુફ ભાઈસાહેબના કુટુંબીજનોથી).

એ વખતે સૈફી મહલમાં ઘણી ઉથલ પાથલ થઇ, ખાસ કરીને નિશાન ઉપર આમેના આઇસાહેબાના કુટુંબીજનો હતા. દાવો એમ કરવામાં આવ્યો કે આમેના આઇસાહેબાના કુટુંબીજનો બુરહાનુદ્દિન મૌલાની ઇચ્છાઓ ને પરીપુર્ણ કરતાં નથી. આ બન્યુ જ્યારે રીદા, તોપી વગેરેની ઝુંબેશ શરૂ કરવામાં આવી. આ ઝુંબેશ ની પરાકાષ્ઠા યુસુફ ભાઇસાહેબની મુલતકા હતી, જે બોહરા કોમ ને પરિવર્તિત કરી આજની પરિસ્થિતિમાં લઇ આવી છે. આ જ સમયે સચૈદી સાલેહ ભાઇસાહેબ ને નીચે ઉતારી પાદવામાં આવ્યા - મૌલાની ઇચ્છાઓ ને પરીપુર્ણ ન કરવા ને કારણે - અને આમેના આઇસાહેબાના કુટુંબીજનો ને પણ, કે જેઓ હંમેશાં શિક્ષણ અને આધુનિકતા ના હીમાયતી હતા, ઉતારી પાદવામાં આવ્યા એજ સ્તર સુધી. દાવો એમ કે આમેના આઇસાહેબાના કુટુંબીજનોનો મજબૂત નથી જેટલો યુસુફ ભાઇસાહેબના કુટુંબીજનોનો. (ફાતેમા આઇસાહેબાના કુટુંબીજનો).

યુસુફ ભાઇસાહેબે મુલતકા એવી રીતે તૈયાર કર્યું કે બુરહાનુદ્દિન મૌલાને માન્યતા આપવી જ પડી. એમની પાસે કોઇ વિકલ્પ રહ્યો નહી, ઝુંબેશ દરમીયાન કે મુલતકા પહેલા. યુસુફ ભાઇસાહેબે કહ્યું કે આખું સૈફી મહલ સુરત આવે અને બુરહાનુદ્દિન મૌલા પાસે માફી માંગે, કારણ કે તેઓ બધા ઉપર ખુબ ખફા છે. પહેલીજ વખત સૈફી મહલના સદસ્યો એ અનિર્ણયાત્મક મનોદશા અને અસલામતી અનુભવી, ખાસ કરીને જેઓ ફાતેમા આઇસાહેબાના કુટુંબીજનો માંથી નહોતા. આમેના આઇસાહેબા અને વચઝીરા આઇસાહેબા ના બાળકો એક પછી એક નાના મોટા બધાજ બુરહાનુદ્દિન મૌલા પાસે આવી માફી માંગી - ઘણાને તો ખબર પણ નહોતી કે શામાટે માફી માંગાઇ રહી છે - પરંતુ તેમના પાસે કોઇ વિકલ્પ નહોતો. કોઇ પણ આ ઝુંબેશ ઉપર કે ઝુંબેશકારો પર સવાલ ઉઠાવી શકે એમ નોહતું. ઓછામાં ઓછું જગજાહેર. આ વખત પછી અસરા નું આયોજન ક્યારેક જ મુંબઇમાં થયું.

સૈફી મહલ ની અંદર ની વાતો.

બધાને એક કતાર માં લાવો: લેખ ૩ તા.૧૯/૧૨/૧૪

મુલતકા ના આસપાસ ના સમય દરમ્યાન સૈફી મહલના પુખ્ત ઉંમરના સભ્યો પોતાનું ભરણપોષણ પોતે કરતા, અનેવાસ્તવિક દુનિયામાં રહેતા. ઘણા પોતાનું ભવિષ્ય સુધારવા પરદેશ ચાલ્યા ગયા. જે મુંબઇમાં રહી ગયા તે મહામહેનતે તેમનું ગુજરાણ આપના બધાની જેમ ચલાવતા.કેટલા પાસે નોકરી હતી તો કોઇ નાનો મોતો વ્યાપાર કરતા. ફરી પાછા યુસુફ ભાઇસાહેબ મદદે.બધાને એકજ કતારમાં લાવવાની નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી. પજવણી

સરૂ કરવામાં આવી. જે લોકો નોકરી કરતા હતા તેમને સૌથી વધારે ખરાબ ગણવામાં આવ્યાં. અગર તમે ખીદમતમાં નથી તો તમે કઈજ નથી. ફરી પાછું સૈફી મહલ આ નવી ઝુંબેશ થી હલબલી ગયું. જે લોકો જામીયામાં દાખલ થવાની ઉંમર વતાવી ચુંક્યા હતા, તેઓને આમીલ બનવા માટે સખતાઈ કરવામાં આવી. જે લોકો સ્કુલ અને કોલેજમાં ભણતા હતા તેમને જામીયામાં જવાનું કહેવામાં આવ્યું, અગર તેઓને ભાઈસાહેબ રેહવું હોઈ તો. આ એક કાળજીપૂર્વક દબાણનું પ્રમાણ હતું.

સસરાના મરણ પછી, મુફ્ફદલ ભાઈસાહેબે જામીયા અને અમાલત ની ઝુંબેશ ચાલુ રાખી. જે લોકો અમાલત ન કરી શક્યા તેમને બદરી મહેલના કાર્યાલયમાં મોકલી આપ્યાં. મુઠ્ઠીભર માણસો કે જેઓ ઝુંબેશથી પ્રભાવીત નહોતા તેઓ પોતાની મરજીના માલીક હતા. તેઓ સહેલાઈથી નભાવી લેવામાં આવ્યાં પરંતુ માનસન્માન વગર – કોથારીઓ તરફથી પણ. છેવટે આ મુઠ્ઠીભર માણસો પણ ખરેખર કોઈ ને કોઈ રીતે સંકલાએલા રહ્યાં – શાહઝાદા જ્યાં પણ જાય તેના સાથે અંગત સહાયક તરીકે, કે પછી બદરી મહેલના ફેરા કરવા,એક અપેક્ષા થી કે કોઈ આદુઅવલુ કામ અહીંતહીં મલી રહે.

ફરી પાછા આજના સમયમાં આવી યે તો, અપને જોઈ શકયે છે કે સૈફી મહલમાં ભાઈસાહેબો મુફ્ફદલ ભાઈસાહેબના વિરુદ્ધ મોઢું ખોલી શકતા નથી. અને જામીયામાં ભણેલી ભાઈસાહેબોની નવી પેઢી - સંપૂર્ણપણે બહારના વિશ્વ

માટે તૈયારી વગરની- નવા આમીલો છે અને નવા આગેવાનો છે મુફ્ફદલ ભાઈસાહેબના રાજમાં. આ નવી પેઢી સૈયદના તાહેર સૈફુદ્દિનના પોત્ર,પોત્રીઓ, કે બીજી પેઢી ના પોત્ર,પોત્રીઓ છે. બહારના વિશ્વ સાથે ટકી સકવામાં અયોગ્ય અને તમને અને મને સમજાવવામાં અસમર્થ ખાસ કરીને પશ્ચિમી દેશોમાં રહેતા અને નવી વિચારસરણી વાલા મુમેનીનો ને.આ સૈયદના તાહેર સૈફુદ્દિનનુ સ્વપનું ન હતું જે પોતે ભવિષ્ય માટે જોયું હતું.

સૈફી મહલ ની અંદર ની વાતો.

તમે મારા ભાઈ નથી: લેખ ૪ તા.૧૯/૧૨/૧૪

સૈયદના તાહેર સૈફુદ્દિનના વફાતના બાદ સૈફી મહલ એક મોટું કુંદુંબ હતું. દરેક વ્યક્તિ ખરેખર એક સામાન્ય પરિવાર તરીકે આનંદથી રહેતા હતા. પરંતુ જ્યાંરે એસ.કે.કયું ને માઝુન જાહેર કરવામાં આવ્યા અને આમેના આઈસાહેબાના કુટુંબીજનો શક્તિશાળી થયા તેથી દુખના વાદલો ઘેરાવા લાગ્યા અને ઘણા થઈ ગયા.(જુઓ જુની પોસ્ટ ૧ આમેના આઈસાહેબાના કુટુંબીજનો

એસ.કે.ક્યું થી પલતવાર). આ લોકો સૈયદના તાહેર સૈકુદિનના જુવાન શેહઝાદા અને શેહઝાદી ઓ હતા અને દુન્યવી શિક્ષિત અને આધુનિક હતા. ફાતેમા આઇસાહેબાના કુટુંબીજનો જીવનસંઘર્ષમાં તક કે અવસરથી સર્વથા વંચિત રહેવાનો અનુભવ કરવા લાગ્યા - અનેક વાર આ તેજસ્વી વિરોધિઓ થી. આ રીતે ઈર્ષા નો ચરુ ઊભરાવા લાગ્યો - જુના રીતીઓ તરફ. યુસુફ ભાઇસાહેબ આ ઉલતપુલત કરવામાં મુખ્ય પાત્ર હતા.

પરંતુ આ વિચિત્ર વાંકું વલણ રહસ્યમય હતું, યુસુફ ભાઇસાહેબના કૌટુંબિક સંબંધ તેમના પોતાના કૌટુંબ સાથે સારા નહતા - ફાતેમા આઇસાહેબાના કૌટુંબીઓ. હકીકતમાં તે એક વાસ્તવિક મુદ્દો હતો અથવા ખાસ કરીને - કાસીમ ભાઇસાહેબ, તેના સગા નાના ભાઇ સાથે. એટલું મોટું વિભાજન હતું કે જ્યાંરે કોશરઅલી (યુસુફ ભાઇસાહેબના દીકરા) એ કાસીમ ભાઇસાહેબની દીકરી માટે લગ્ન વિષે પ્રસતાવ મુક્યો તે અશક્ય અને અવિચાર્ય કૃત્ય હતું. કાસીમ ભાઇસાહેબ હંમેશા તેમના ભાઇ સાથે ઈર્ષ્યા કરતા હતા. મોકો મલતા, તેઓ સ્પષ્ટ રીતે શબ્દોને તોલમોલ કર્યા વગર સંભલઅવી દેતા. જ્યાંરે યુસુફ ભાઇસાહેબ અમેરિકા ના ચીકાગો શહેરમાં હતાં. તેમણે ત્યાં એક નાનો મુલતક યોજ્યો હતો. કાસીમ ભાઇસાહેબ ઘણા ગુસ્સે થઇ ગયા જ્યાંરે પોતે અમેરિકા ગયાં અને પોતાના માટે મુલતક નુ આયોજન ન થયું. તો આછે કાસીમ ભાઇસાહેબ - મુફ્ફદલ ભાઇસાહેબના મુકાસીર. અહિં બીજા કોઇ વિશેષણ ની જરૂર નથી.

બધા સમયે બુરહાનુદ્દીન મૌલાના શાહઝાદાઓ યુસુફ ભાઇસાહેબ ના વશીકરણમાં રહેતા. તેઓ ખૂબ જ સારી રીતે તેમની તમામ ચાલ ખેલતા. તેઓ તેમના પ્રવચન દરમિયાન જાહેરમાં કહેતા - ઘણા પ્રવચનઓમાં - બુરહાનુદ્દીન મૌલાના સામને વિવિધ મજલીસોમાં - કે તેઓ એતલા બધા ધન્ય હતા કે બુરહાનુદ્દીન મૌલાએ તેમને તેમના પોતાના શાહઝાદાઓથી પણ ઉપર બેસવાની મંજૂરી આપી છે. આ કાર્ય હતું મસ્કા લગાડવાનું, પરંતુ મધમાખી ફૂલ તરફ ખેંચાંઇ એમ શાહઝાદાઓ માટે થયું. આ અમૃત ખૂબ જ મીઠું હતું. કોઇ પણ શાહઝાદા કોઇ પણ કાચ યુસુફ ભાઇસાહેબની રજામંદી વગર કરતા નહી. આ લોકો માટે બુરહાનુદ્દીન મૌલા ફક્ત એક સત્તા વિનાના વડા હતા. ખરી સત્તા યુસુફ ભાઇસાહેબ ના હાથમાં હતી. જેઓએ તેમને અનુભવ્યાં છે તેનાથી ખાતરી કરી શકાય છે. આગળ કઈ પણ ઝીણવટભર્યું કહેવા ની જરૂર નથી.

હવે બીજો ધમાકો. બુરહાનુદ્દીન મૌલાની ખુશી હતી કઇ સફીયા બાઇસાહેબા (એસ.કે.ક્યું ના દીકરી) મુફ્ફદલ ભાઇસાહેબ સાથે શાદી કરે. મારા શબ્દ “ખુશી” ની અહી નોંધ લેશો. પરંતુ યુસુફ ભાઇસાહેબની શેહઝાદી, ઝોહરા બાઇસાહેબા, એ એવી ચાલ ચાલી કે મુફ્ફદલ ભાઇસાહેબને

સફીયા બાઇસાહેબાથી તલાખ લેવી પડી. તમારા પોતાના અનુકૂળતા માટે " ખુશી " નો ઉપયોગ કરવો ઘણું કહેવાય. અને પછી શું થયું તે તમે સમજી શકો છો.

સૈફી મહલ ની અંદર ની વાતો.

સંક્ષિપ્ત હેવાલ મુલતકાનો: લેખ ૫ તા.૨૦/૧૨/૧૪

સંક્ષિપ્ત હેવાલ મુલતકા નો http://akhbar.mumineen.org/archive/sharia/fatemi_mutlaqa/

આ મુલતકા જ્યાં સુધી મુમેનીનોને શરિયત ઉપર પરત લાવવા માટે હતો ત્યાં સુધી સકારાક્રમત હતો, એના નકારાત્મક પાસાઓમાં શાહઝાદાઓ, ભાઇસાહેબો, આમીલો અને કોથારીઓ એ પ્રચંડ અધિકાર કાબૂમાં લીધા. આ ત્યારે કે જ્યાંરે લાલ, પીલી અને લીલી સફાઇ ચિથ્થી નો જનમ થયો. જેથી- અધાર્મીક દૃષ્ટિકોણ તરફના વલણ ઉપર પણ ધરમૂળથી ફેરફાર થયો. જેમ ખાસ કરીને સૈયેદી સાલેહ ભાઇસાહેબ નો વલન ઉદાર અને પ્રેમથી લોકોને વિશ્વાસમાં લેવાનો હતો તેના બદલે આધુનિક “માફીઆ” અને ગુન્ડાગિરિનો કાનૂન શરૂ થયો. માફી કે હળવી સજાનો યુગ પુરો થયો. જ્યોર્જ બુશ ના જેવો નવો દોર સરૂ થયો. – કાતો તમે અમારા સાથે છો યા અમારા વિરુદ્ધ છો.

સમુદાયના કેટલાક અનુયાય માટે, આ કડક અમલથી વ્યવહાર કરવો ખૂબ જ અસહનીય હતો, તેથી તે લોકોએ સમુદાય છોડી દીધો યા બે વખત હાજરી આપતા થઇ ગયા – તેઓ બે વખત લઇલતુલ કદર અને આસુરામાં જોવામાં આવે છે. દુન્યવી શિક્ષણ માટે ઉત્તેજન આપવાનાં એ દિવસો ગયા. યુસુફ ભાઇસાહેબે કવિતા લખી:

[યમક અનવર.pdf](#) ૧.૫૮ એમ.બી.

દાઉનલોડ કરો

આખી કવિતા વાંચો..

પદવી કે ઊપાધિ વાલા ઉપર ભવાં ચડાવવામાં આવ્યા, ફક્ત તબીબી તેમજ અન્ય વિદ્યામાં ઊંચી પદવી ધરાવનાર ને બાદ કરીને. આ સુયોજન એટલી સારી રીતે કરવામાં આવ્યું હતું કે આપને બધા વિચાર વા લાગ્યાં કઇ – ગણા હજુ વિચારે છે કે – મુતલકા બુરહાનુદ્દીન મૌલા ના આદેશ થી કરવામાં આવેલો. પરંતુ એ યુસુફ ભાઇસાહેબ ના દિમાગ ની ઉપજ હતી.

સૈફી મહલ ની અંદર ની વાતો.


બુરહાનુદ્દીન મૌલાને બાજુ પર મુંઝ્યા: લેખ ૬ તા.૨૦/૧૨/૧૪



Al-Jamea-tus-Saifiyah

The crest of Aljamea-tus-Saifiyah, embossed in gold on the outside of the masjid at Aljamea-tus-Saifiyah.

Pandit Jawaharlal Nehru looking through one of the books written by Syedna Taher Saifuddin at the exhibition of rare Arabic manuscripts and books organised at the time of the Late Prime Minister's visit to Aljamea-tus-Saifiyah.



This oldest centre of Islamic learning in the sub-continent, nay Far East, was given a new direction by the 51st Dai-al-Fatimi, when he initiated a fresh educational upsurge and freed it from the clutches of the so called selfstyled Ulemas. El-Dars-el-Saifi was developed on new lines and became aptly known as Al Jameatus Saifiyah.

The Academy was beneficiary of a rebuilding programme chalked out by Syedna Taher Saifuddin. A new Masjid for the Academy was built by him. Syedna Burhanuddin continued the building process under which the 180 years old structure would be replaced and an enlarged campus

suited to the modern educational needs created. In this way, a worthy successor through munificence combined with awareness of the Academy's vital position has provided a monumental upsurge for the Fatimi philosophy of learning and upbringing and contributed to the educational and spiritual growth and strength of the community.

He also made it known internationally by its participation in international seminars and conferences, by its degrees being recognised by various universities and academies, and by its effective programme of expansion of its teaching services.

પુસ્તિકા જે ઉપર પ્રસિધ્ધ થઈ છે - આવી ઘણી પ્રસિધ્ધ કરવામાં આવી છે - અહીં યુસુફ ભાઈસાહેબ જામીયાની સિદ્ધિઓની નોંધ લે છે. આ પુસ્તિકા પ્રસિધ્ધ કરવાના સમયે યુસુફ ભાઈસાહેબ જામીયાના વડા કે અમિરૂલ જામીયા હંતા. અહીં આ પુસ્તિકા ના પૃષ્ઠ પર પાછળથી જાગતા ડહાપણની નોંધ લેવા જેવી ઘણી વસ્તુઓ છે. પ્રથમ જુઓ કે બુરહાનુદ્દીન મૌલા ક્યાં ઉભાં છે. યુસુફ ભાઈસાહેબ નેહરૂના જમની બાજુ માં છે. બીજી નોંધ કરો કે જામીયાની સિદ્ધિઓનો ઉલ્લેખ કેવી રીતે કરવામાં આવ્યો છે - જાણે પોતેજ સર્વસવ છે. અને નીચેના પાના ઉપર પુસ્તિકાના છેલા પૃષ્ઠ ઉપર તેઓની પોતાની તસ્વીર છે - જે પોતે બુરહાનુદ્દીન મૌલા ને ભેંટ આપી રહ્યા છે.



"75 Momentous Years" by Dr. Yusuf Najmuddin— A humble token presented.

Published by the
DEPARTMENT OF STATISTICS
AND INFORMATION,
Dawate-Hadiyah, Badri Mahal,
Dr. D.N. Road, Fort, Bombay 400 001.

Printed at
ELECTRO PRINT,
157 Mody Street, Fort, Bombay 400 001.

March 1987
Design : Qasim Aymen

સૈફી મહલ ની અંદર ની વાતો.

મુફ્ફદલ ભાઇસાહેબ શરૂથી કાળજીપૂર્વક પસંદ કરવામાં આવેલા: લેખ ૭ તા.૨૦/૧૨/૧૪

અહિં નોંધલો કે શરૂઆતથી મુફ્ફદલ ભાઇસાહેબને તેમના સસરા દ્વારા કીર્તિવાન બનાવવાના પ્રયત્નો અને

Changes in Yemen The Vigilant Leader

Syedna Mohammed Burhanuddin who was now popularly known by the rare title of *Mansur-el-Yemen*, next turned his special attention to the followers in Yemen. Their isolation and lukewarm attitude to *Deen* and




Aqeedah had to be corrected. Earlier he sent his son, Shezada Mufaddal Saifuddin to Yemen with specific instructions that after obtaining the permission of the new Government, he should start the rebuilding of the mausoleum of Syedna Hatim, the 3rd Dai-al-Mutlaq at Al-Hutaib-el-Mubarak. This construction was a signal for the truthful followers, that their affairs would now take a positive turn. There was great jubilation over the dedication of the rebuilt mausoleum. Shazada Saifuddin was given the title of '*Aqeeq-el-Yemen*'.

Within the precincts of a Masjid in Yemen Arab Republic. Discussing improvements.

15

નોંધલો કે ઇમામુંઝ ઝમાનના માઝુંન નું નામોનિશાન નથી આ ઉંપરાન્ત કે નિચેની પુસ્તિકામાં યુસુફ ભાઈસાહેબે માઝુંન સાહેબની તસ્વીર છાપવી પડી છે - ભલે છેલા પૃષ્ઠ ઉપર - પણ વાદ રહેં તેઓ આ પુસ્તિકામાં બુરહાનુદ્દીન મૌલા ને આપી રહ્યાં હતાં. ભલે છેલા પૃષ્ઠ ઉપર. અને

તમને કદાચ સવાલ થશે કે આબાબતમાં માઝુન સાહેબની શું સિદ્ધિ હતી? જવાબ છે ઘણી હતી, પણ યુસુફ ભાઈસાહેબની દુરઅંદેશી તમને વિચાર કરતા કરી દેશે.



52nd Dai, Syedna Mohammed Burhanuddin, is destined to attain unprecedented heights. The Dai is in every way helped by sons and daughters, all graduates and well qualified even by Western standards. They provide for the youth of the Community a worthy example of how secular education should be blended with Islamic lore and how acquired knowledge must be reflected in deeds and actions that takes man to the goal of purposeful living.

Coming generation nurtured by love and blessings.



સૈફી મહલ ની અંદર ની વાતો.

બુરહાનુદ્દીન મૌલાનો (રા) વારસો: લેખ ૮ તા.૨૦/૧૨/૧૪

50 વર્ષ માં બુરહાનુદ્દીન મૌલા જે પ્રગતિ લાવ્યાં તે દાવતે સદીઓ સુધી જોઈ નોહતી, જાણે ઇમામ પોતે ઝુહુર થયા હોય. મસ્જીદ હોય કે ઘર, મુમેનીનોએ વિશાળ બરકત જોઈ જે આ પહેલાં વર્ષો સુધી જોવામાં આવી નહોતી. અને ફરી ફરીને બુરહાનુદ્દીન મૌલાએ બધાં ને ખુશહાલ રાખ્યાં.બધાં ને. તેમણે જેટલો થઈ શકે તે પ્રયાસ કર્યો. પણ તેઓ ફરિસ્તા હતા, પણ દુનયવી મર્યાદા ઘણી હતી. જેમ કે તમે ઉપરના લેખોથી જોઈ શકસો કે તેઓએ દાવતમાં સુલેહશાંતિ જલવાઈ રહે તે માટે ઘણું સહન કર્યું છે. તેઓએ ઇમામુઝ ઝમાનના માર્ગદર્શન હેથલ કર્યું, જેમ તેમના અગાઉના બીજા દાઈઓ કરતાં. તો પછી શા માટે આ સોનેરી યુગ માં હાનિકારકોના અસ્તિત્વમાં હોવાનું જાહેર કરવાની જરૂર છે?

શામાટે? કારણ કે હાલમાં અપને ઘણા ભિન્ન યુગ માં છીએ. સુરક્ષા જે બુરહાનુદ્દીન મૌલાથી અપને બધાને મલતી, એ આજે ઇતિહાસ બની ચુકી છે. હરએક દાઈના પછી નવા દાઈ શ્રદ્ધાળુઓ માટે જવાબદાર હોઈ છે. પરંતુ આપને સગલા ધર્મસંકટમાં છે કે નવા દાઈ કોણ છે? તેથી વર્તમાનકાળ ને સમજવાં માટે ભૂતકાળને સમજવું પડસે. એજ પ્રમાણે આ 50 વર્ષના આ સોનેરી યુગમાં હાનિકારકો એટલા શક્તિશાળી હતા કે તેઓ દાવતની નસોમા પેવસ થઈ ગયા હતા. આ નવા સમાચાર થી, અપણે બુરહાનુદ્દીન મૌલાના મોઅઝીઝા થી ઘણી દહેશતનો સામનો કરવાની શક્તિ મલસે, જેમ તેઓએ દુષ્ટ લોકોના વચમાં રહીને અપણે સોનેરી યુગ આપીયો.

આ દુષ્ટતા માઝુનની બદગોઈ અને માનભંગ કરનારી હતી. આપહેલા ક્યારે પણ દાવતુલ સતરના ઇતિહાસમાં દુષ્ટ લોકોએ આટલી જબરદસ્તી થી ત્રાટકીયા નથી અને એ પણ આટલા લાંબા સમય સુધી. કલ્પના કરો કે બુરહાનુદ્દીન મૌલાના માઝુન મહીના, વર્ષો, દાયકા સુધી ચૂપ બેસા રહ્યાં - ખાનગી વાતને સજ્જડ પકડીને બેસી રહ્યાં કે જે ખાનગી વાત ફક્ત દાઈનાં મૃત્યુ પછીજ જાહેર કરવાની હતી. કેવી રીતે ઘણા મનુષ્યો પ્રચંડ દબાણ સામે ટકી શકે છે - પોતાના કુટુંબીઓ સામે, પોતાની શ્રદ્ધા ની મર્યાદામાં રહીને, પોતાની દુનિયામાં રહીને. બુરહાનુદ્દીન મૌલા એ અપણા બધા માટે શીક્ષા ની એવી તૈયારી કરી છે કે અપને અપની અકલ વાપરીને સમજી શકીયે કે શું થઈ રહ્યું છે. સૈયદના તાહેર સૈફુદ્દીન (૨) પોતાના તત્વજ્ઞાનના પ્રવચનમાં કહેછે કે:

العقل في الانسان اعلى الجوهر
متلالي في نفسه كالزهر

અલ-અકલ મનુષ્યમાં સૌથી વિશિષ્ટ પ્રકાર છે.

ચંદ્ર જેવો તેજસ્વી, આધ્યાત્મિક અંશ.

ચંદ્ર બહારથી પ્રકાશ મેળવવા માટે ક્ષમતા ધરાવે છે - સૂર્ય થી. એ જ રીતે, માનવજાત માં અલ-અક્લ બહારથી પ્રકાશ મેળવવા માટે ક્ષમતા ધરાવે છે. જોકે પ્રથમ બહારથી ઉચ્ચ પ્રકાશ મેળવવા માટે તેને તૈયાર કરવી પડે છે. આ તૈયારીઓ મીસાકનાં અંદરજ જીવંત અને મોજૂદ છે. પરંતુ છેલા યુગમાં આ તૈયારી ઓને સત્ય માંથી પાપી બનાવી દેવામાં આવી છે. માઝુન ની બદગોઈ કરવું એ પાપ છે. તેથી બહારના ઉચ્ચ ઉગમસ્થાન થી પ્રકાશ મેલવવું શક્ય નથી - ત્યારે જ અને ત્યાં સુધી કે શરતો ફરી પાછી શુદ્ધ બને કે મીસાક ને ફરી સંભારવામાં અને વિગતવાર કહેવામાં આવે.

સૈફી મહેલ ની અંદર ની વાતો.

અમાલત કે ધબડકો લેખ ૯ તા.૨૦/૧૨/૧૪

એવી દુનિયામાં કે જ્યાં ઇસ્લામ નેજ પડકાર કરવામાં આવે છે, અપની પાસે આમીલો છે જે દુન્યવી પડકાર છે. સૈફી મહેલના પુરુષો કાતો આમીલો છે કે પછી બદરી મહેલ માં નૌકરો છે. તેમ છતાં તેઓ માને છે કે તેઓ વાસ્તવિક દુનિયા સાથે સંપર્ક છે. તેઓ એક પરપોટો માં જીવે છે જે ક્યારે પણ ફાટી શકે છે. જમાનાના સંદર્ભમાં કોઈ પણ પડકાર માટે બાહોશ નથી, કોઈ સવાલોના જવાબ આપવા કાબીલ નથી. જવાબો એવાં આપવામાં આવે છે કે તમને જમાત માં નીચલી કક્ષાએ ઉતારી પાડવામાં આવે છે. આ બુરહાનુદ્દીન મૌલાનું સપનું નોહતું. વફાદારોને વ્યક્તિગત અને ભાવનાત્મક કટોકટીમાં મદદ કરવાને અસમર્થ, આપના જુવાનોની સમસ્યા ને સમજવાને અસમર્થ, આપણે જે દુન્યામાં રહીએ છે તેને સમજવાની ઇચ્છા નહીં. બન્ને, મુફ્ફદલ ભાઇસાહેબ અને તેના આસપાસના સૈફી મહેલના ભાઇસાહેબો, વફાદારોને ક્યાંય પણ ન જતા રાસ્તે દોરવી રહ્યાં છે.

ઘણા સૈયદના તાહેર સૈફુદ્દીનના (૨) દીકરીઓ, દીકરાઓ, પોત્રો, પોત્રીઓ, પરપોત્રો પરપોત્રીઓ ની ઉંછેરની એક ચઢુદી બાઇ એ કરી. હાં ચઢુદી. જ્યાંરે ઇઝરાયેલની રચના કરવામાં આવી હતી - આ બાઇ સૈયદના તાહેર સૈફુદ્દીનની મમતાથી સારસંભાળ રાખતા - ત્યારે પોતાનું વતન સમજીને બેર સાહેબામાં સ્થાયી થય ગયા. મુફ્ફદલ ભાઇસાહેબ જ્યાંરે આજે સત્તામાં છે - જેઓ ખુલ્લો તિરસ્કાર કરે છે - અન્ય ધર્મોના લોકોથી - જેને આપણે અહલ-અલ-કિતાબ સમજીએ છે. તો સું સૈયદના તાહેર સૈફુદ્દીન એ ભૂલ કરી હતી - મુફ્ફદલ ભાઇસાહેબના અનુસાર - આ બાઇ ને કસરે આલીના સભ્યોને ઉછેરવાની પરવાનગી આપીને?! તેમનું છેલ્લું નામ ભલે સૈફુદ્દીન

હોઈ શકે છે, પરંતુ એમ જોવાઈ છે કે ફક્ત એ નામનું જ સામ્ય તેના દાદા સાથે હતું. કોઈ વધુ ખુલાસની જરૂર નથી.

તેથી કલ્પના કરો કે તમે પશ્ચિમમાં રહો છો. તમને એક આમીલ સૈફી મહેલ કે જામીયા માંથી મોકલવામાં આવ્યાં - એમને તમે રહો છો એ દુનિયાનું બહું થોડું જ્ઞાન છે. અને હું જાણુ છું કે જામીયાનું નામ લઈશ તો કેટલાક તરાપ માટે તૈયાર થઈ જશે, પરંતુ જામીયાની પદવી ધારી - બુરહાનુદ્દીન મૌલાના સપના પ્રમાણે - દીની શિક્ષિત ઉપરાન્ત દુનિયવી શિક્ષિત પણ હોવુ જરૂરી હતુ. ધારો કે કોઈ યુવા એ પશ્ચિમમાં જ જનમ લીધો છે અને ત્યાંજ મોટો થયો છે,કોઈ સંકટસમયમાં ફસાયો છે, શું તમે આ યુવક કે યુવતીને સલાહ સુચન માટે આમીલ પાસે લઈ જશો?! તમે આ સવાલનો જવાબ જાણો છો, તેથી કોઈ વધુ ખુલાસની જરૂર નથી.

તો શું એક નેતાની કાયદેસરની ફરજ નથી કે તેની ખાતરી કરે કે તેના આમીલો - ખાસકરીને જામીયાની પદવી ધરાવતા - આધુનિક દિવસોની કટોકટી સંભાળવા સજ્જ હોય? પરંતુ અહીં, જે નેતા છે તે પશ્ચિમ વિશે ખરાબ બોલે છે. સમુદાયથી અલગ રહેવાંની સલઅહ આપે છે, અને યુવાનોને જામીયામાં જવા પ્રોત્સાહિત કરે છે. તેઓ એમ શું નથી સમજતા કે દરેક જણ એક જ પ્રકારનુ શિક્ષણ મેલવશે તો, ભવિષ્યમાં સંકુચિત વૃત્તિવાળાં અને સંકુચિત જાણકારીવાળાં આગેવાનો પેદા થશે? અને કેવી રીતે પશ્ચિમમાં અલ્પસંખ્યક મુસ્લીમો હોવાથી, કસોટી ઓનો સામનો કરશું? અપની આસપાસની દુનિયામાં સુલેહશાંતિથી રહેવા માટેં અપને અપના આસપાસ ની દુનિયાને જાણવી જરૂરી છે, નહીં કે વેગળા રહેવું. બુરહાનુદ્દીન મૌલા એ આવી શીખ આપી નહોતી.

હકીકતમાં જ્યાંરે બુરહાનુદ્દીન મૌલા અમેરીકા ૧૯૮૬ માં પધારેલાં,ત્યારે તેમના ન્યુયોર્ક માં બયાનમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનું મહત્વ અને સમાજના કે તેના જૂથનાં નૈતિક વિચારો અને વલણ વિષે ફરમાવ્યું હતું. તેઓએ આગલ જઈને અમેરીકાના ગુણો અને ધૈર્યને સરાવ્યા હતાં. અમેરીકામાં તેઓ જ્યાં પણ ગયા અને જેણે પણ મલ્યાં તે બધાં એમની વિનમ્રતાથી એમના, જ્ઞાનથી અને એમની આધ્યાત્મિકતાથી ચકિત થઈ ગયાં. યુસુફ ભાઈસાહેબ, મુફ્ફદલ ભાઈસાહેબ ના સસરા, પોતે પણ દુનિયવી ઊંચ્ય શિક્ષાથી શિક્ષિત હતાં. જે લોકો યુસુફ ભાઈસાહેબને જાણે છે તે આ વાતની પુષ્ટિ કરશે કે તેઓ બધા પ્રકારના શિક્ષણથી શિક્ષિત હતાં.

તેથી હવે તે માનવું મુશ્કેલ નથી કે સૈફી મહેલમાં કોઈ પણ મોઢું ખોલતું નથી. તેઓમાં કેટલા છે જેઓ અમાલત છોડીને વાસ્તવિક દુનિયામાં આવે અને અમારી જેમ કામ કરે? કેટલામાં હિંમત

છે કે બદરુલ જમાલી અને તાહા હકિમુંદીનની બિહામણી અને હિંસા ભરી ધમકીઓના સામે અવાજ ઉંઠાવે – જેઓના અંકુશમાં બુરહાની ગાર્ડ અને તોલોબા છે?! ખરેખર બુરહાનુદીન મૌલાના ના મુકાસીર પણ અવાજ ઉંઠાવતા ગભરાય છે. અપણે બધા યાદ કરી શકીએ છે, કે આજ મુકાસીરે જાહેર-બાતીનની વિચારસરણીનું ઉગ્રતાથી ખંદન કરેલું.

સૈફી મહલ ની અંદર ની વાતો.

ધર્મ રક્ષક લેખ ૧૦ તા.૨૦/૧૨/૧૪

એક કલ્પના કરો કે દાવત માં સૌથી જ્ઞાની જૂથ જામીયાના સ્નાતકો અને વિદ્યાર્થીઓ છે.આ લોકો ધર્મના સાચા રક્ષક છે. તો તેઓ ક્યાં હતા કે જ્યાંરે અહમ માઝુનના રૂતબા - જે મીસાક માં છે- ને ફાડી નાખવામાં આવ્યું? મીસાકના એક ભાગને ફાડવું આખા મીસાકને ફાડવાં બરોબર છે.

કલ્પના કરો કે દુનિયા નો કોઈ પણ માણસ આ વિશે ખુલ્લાં મનથી વિચારશેતો, કલ્પના કરો કે તમે તમારા કોઈ બહારના દોસ્તને મીસાક વિશે સમજાવશો તો.

તમે કહેશોકે પાપમાંથી બચાવવાનો એક માત્ર રસ્તો મીસાક છે – મીસાક વગર પાપમાંથી બચી શકાય નહિ: આ અપની માન્યતા છે. પછી એ પુછે છે કે મીસાકમાં શું છે?

તમે જવાબ આપો છો: વિવિધ નિયમો છે જેનું આપણે પાલન કરવું પડે. જેમકે ખ્રિસ્તી ધર્મમાં ૧૦ પરમેશ્વરના આદેશો છે.

પછી તે તમને કહેશે કે તેને સાંભળ્યું છે કે મીસાકમાં અમુક લોકોના નામ લેવા સામે મતભેદ છે. તમે કહેશો: કેવો મતભેદ? અમે ફક્ત મીસાકમાં ૩ લોકોના નામ લઈએ છે. – જે અમે વર્ષોથી કરતા આવીયા છે.

એ પુછશે: સાચું, તમે મીસાકમાં લોકોના નામ લો છો? તમારો અર્થ પેગંબરોનો છે?

તમે સમજાવશો: ના દાઇ, માઝુન અને મુકાસીર.

એ પુછશે: આ ત્રણ કોણ છે?

તમે કહેશો: દાઇ અમારા ધર્મગુરુ છે અને તેઓ માઝુન અને મુકાસીરની નિમનુંક કરે છે.

પછી એ પુછે છે: કે સાંભળ્યું છે કે તમારા માઝુનને કેટલાક મુદ્દાઓ ઉંપર મતભેદ છે તેથી તેનું નામ કાઢી નાખ્યું છે?

તમે કહેશો: હાં માઝુનને મતભેદ છે, તેથી ખરેખર અમે એને ખરા માઝુન માનતાજ નથી.

એ કહે છે: તો શું તમે હવે પછી અલ્લાહ સામે તેમના નામ દ્વારા શપથ લેતા નથી?

તમે કહેશો: ના, પણ હા ફક્ત રાજકરણના કારણે અમે તેણુ નામ લઈ વે છે

તમારો દોસ્તચક્રિત થઇ તમને પુછશે: તમે કેવી રીતે પરમેશ્વર સામે એક જૂઠા શપથ લઇ શકો. દાઉદી બોહરાઓ માટે જે ઘણો બધો આદર હતો તે ખલાસ થઇ જશે. અને તે આપવા માટે તમારા પાસે કોઇ જવાબ નહિ હોય.

પછી તે પુછશે: તમારી પાસે ધાર્મિક તાલીમ આપતી કોઇ સંસ્થા નથી જે આ બાબત ને ઉઠાવે? તમે કહેસો: છે.

એ પુછશે: ઠીક છે,તો તેઓ શું કહે છે?

તમારો જવાબ હશે: કઇ પણ નહિ.

શું કહી શકો તમે? જામીયા - ધર્મ રક્ષક - જે ધાર્મિક સિક્કાન્તને વફાદાર નથી! એ જામીયાના છાત્રો હતા જેમને જાહીર-બાતીનના ચક્રવાતને હવાં આપી, માઝુનને પછાડિયા, માઝુનની બેહુરમતી કરી, અને છેલે લાનત, આ સેતાની સંદેશો ઘરે ઘર શ્રદ્ધાળુ ઓમાં ફેલાવવામાં આવ્યું. જામીયાની દિવાલોના વચ્ચે એ ખરી કીતાબો પડી છે જેમાં માઝુન વિષે ઇલ્મના ભરપૂર ભંડાર છે, છતાં પણ તેઓ તેમની પોતાની કીતાબોને માનવાનો ઇન્કાર કરેછે.તોશું આ કીતાબો જુથું બોલે છે?! ધાર્મિક સિક્કાન્ત કે શ્રદ્ધા બડલાઇ ગઇ છે?! શું નાવી કીતાબો લખાઇ છે! કોન લખી છે આ કીતાબો.

સૈફી મહલ ની અંદર ની વાતો.

બુરહાનુદ્દીન મૌલાના મોઝીઝા લેખ ૧૧ તા.૨૧/૧૨/૧૪

ઘણા છે ત્યાં બહાર જે મોઝીઝાની પ્રતીક્ષામાં છે કે બુરહાનુદ્દીન મૌલા તેમને રસ્તો બતાવશે.એ લોકો પાકા પાચે ભરોસો નથી કે કોણ દાઇ છે, પણ સગવડ ખાતર મુફ્ફદલ ભાઇસાહેબને અનુસરે છે. સમજી શકાય કે કોઇને તેમના જીવનમાં વધું તણાવ જોઇતું નથી. અમારી પાસે પહોંચી વલવા પહેલાથી જ નોકરી/ધંધો, કુટુંબ, મીત્રો છે. તણાવ માટે ધાર્મિક મુદ્દાઓ છેલ્લી વાત છે. હકિકતમાં ધર્મ આપણને દિલાસો, શાંતિ, આશ્વાસન અને સુરક્ષા માટે અપેક્ષિત છે. આ કઇ દાઉદી વહોરાઓ માટેનો ઉદાહરણ નથી. તો આ લોકો જે પ્રતીક્ષામાં છે - ક્યાં સુધી પ્રતીક્ષા કરશે?!હવે તો ક્યારનું એક વરસ પણ પુરૂ થયું.

કઇ વાર જોવાની જરૂર નથી. મોઝીઝો તમારા સામને છે. એક માનવી છે જે ૫૦ વરસ સુધી ચૂપ બેસી રહ્યાં. એક ગુપ્ત વાતને મજબૂતીથી પકડી રાખી, પોતાના પરિવારને,પોતાની પ્રતિષ્ઠાને,આખી આસપાસની દુનિયાની પરવા કર્યા વગર. એજ અરસામાં તેઓ પોતાના ઉપર થતાં હુમલાનો પ્રતિકાર પણ ન કરી શક્યાં- આ ગુપ્ત વાતની જાલવની માટે. એક વર્ષ પહેલા

જ્યાંરે દાવત ઉપરથી સુર્યાસ્ત થયો અને કદી ન જોયેલા એક યુગનો અંત થયો. આ માનવીએ ગુપ્ત વાતને બહાર પાડી.૫૦ વરસ પછી. એમને આમ કરવાંની જરૂર હતી?!. તેઓ પાસે કોઈ કારણ નોહતું. તેઓ તેમના જીવનના બાકીના દીવસો અરામ અને શુક્રન સાથે તેમના નિકટતમ કુટુંબ સાથે ગુજારી શકતે. તેમણે કોઈ સંપત્તિની જરૂર નહોતી, તેઓને પહેલેથીજ ખુદાએ ભરપુર સંપત્તિ આપી છે જેનાથી તેમના નિકટતમ કુટુંબનો ત્યા આવનાર ઘણી પેઢીનું ગુજરાણ ચલાવી શકે. શાં માટે તેઓ જોખમમાં નાખે – એમની શાંતી, એમના પોત્રો, એમની દીકરીઓ, એમની ભાવનાત્મક સુખાકારી, એમની બચત, એમનું સ્વમાન, તેમના આરામ અને ઊંઘ - એક 50 વર્ષ જૂની ગુપ્ત વાતનો બચાવ કરવાં માટે?!

આટલા બધા વરસો, અને બાળપણની યાદો અને કુટુંબનું સંમેલન અને ઈદમીલન અને નાસ્તો અને જન્મદિનનો સૈફી મહેલની પેઢીઓ એ આ માણસ અને તેના કુટુંબીઓ સાથે ગુજારી છે, આંખના પલકારમાં આ નવાઈ પમાડે એવું શા માટે?! એ દિવસોમાં સજદા અને તસલીમ, ચિલ્લાવવું કે માઝુંનસાહેબ પધારે છે, હર્ષ માં તેમની રાહ જોવી કે તેમના આશીર્વાદ મલીશે, આ બધુંજ ભુલાઈ ગયું?! કોઈ યાદદાસ્ત નહિં, આખમાં એક આસુનું ટીપું પણ નહિં? બુરહાનુદ્દી મોલા સાથે મોજ ખાતર “દારુસ સકીના” ની સહેલ પર જ્યાંરે આખું સૈફી મહલ હાજર રહેતું.? શું એ બુરહાનુદ્દી મોલા નહોતા જેમને “દારુસ સકીના” નામ આપ્યું હતું? નથી યાદ આવતું? કઈ પણ નહિં? યાદદાસ્તનું પતન થઈ ગયું. કદાચ. શું તેઓ આવા દુઃખદાયક વ્યક્તિ હતાં? એક દિવસ તમે તેમને તમારા હૃદયથી ચાંહતા અને એકાએક તમે ખરેખર તેના પર લાનત બોલવાનું શરૂ કર્યું?!ઓ મારા ખુદા!

મોજીજા નો ઈન્તીજાર કરો. જેમ કે ટાઇટાનીકમાં બચી ગયેલાઓ જેમને પોતાના કુટુંબીઓને ગુમાવ્યા હતા. જ્યાંરે તેઓએ ફરી પાછો ન્યુયોર્ક મા પગ મુક્યો, એવી આશાએ કે કુટુંબીઓનો ભેટો થશે તે મોજીજો ક્યાંરે પણ સાકાર ન થયો. પરંતુ તેમની આંખો સામે મોજીજો એ હતો કે તેઓ બચી ગયા. વ્યંગાત્મક વાત એ છે કે ગયા વર્ષે ટાઇટેનિક ના ડૂબવા ની ૧૦૦ મી વર્ષગાંઠ હતી – જ્યાંરે બુરહાનુદ્દી મોલા જાન્યુઆરીમાં ગુજરી ગયા.

સૈફી મહલ ની અંદર ની વાતો.

એક રોકાણ અવળી દિશામાં. લેખ ૧૨ તા.૨૧/૧૨/૧૪

સૈયદના તાહેર સૈફુદ્દીને દાવતની મીલકતના રોકાણ માટે વર્ષો ગાળ્યા. તેમના નાના ભાઈ ઇબ્રાહીમ ઝૈનુદ્દીન ભાઈસાહેબ સાથે, તેમનો દિન અને દુનિયા સાથે સરસ તાલમેલ હતો, અને

નાણાંકીય બાબત માં ઘણા શિક્ષિત હતાં. ઇબ્રાહીમ ભાઈસાહેબે દાવત વતી શેરો ,સ્થાવર મિલકતો,અને કંપનીઓ ખરીદી. હોટલો પણ, હા હોટલો. આ પાયા ની શરૂઆત હતી – સ્તંભ ગોઠવાયો - આજે જે દાવતની જાહોજલાલી અપણે જોઈએ છે. વર્ષોના વર્ષો સુધી કરકસર એ પ્રમાણભૂત પ્રથા હતી.સૈયદના તાહેર સૈફુદ્દીન અંગત રીતે દરેક બાલકો કેટલા રૂપિયા વાપરે તેનું તાકીદથી ધ્યાન રાખતા. દરેક પૈસા, પૈસાનો અને આના આનાનો વિગતવાર હિસાબ રહેતો. તેઓ પોતે મીયા સાહેબને કહેતાકે કેટલા પૈસા ક્યાં બાલક ને આપવાં – અને દરેકે દરેક બાલકને જે કંઈ મલે તેનાથી સંતુષ્ટ થવો જોઈએ - પાર્કમાં ફરવા જવાં માટે પણ. બાલકો પાછા ફરતા ત્યાંરે એસ.ટી.એસ.પોતે બાલકોને પુંછતા કે કેટલો ખર્ચ ચના ઉપર અને કેટલો ખર્ચ આઈસ્ક્રીમ કયો. ઇબ્રાહીમ ભાઈસાહેબ - એસ.ટી.એસ.ની નજદીકી અને વ્યક્તિગત દેખરેખ હેથલ - ધીમે ધીમે અને મક્કમ રીતે દાવત માટે રોકાણ કર્યું. જે લોકોએ તેમનું અને તેમના મોટાભાઈ સૈયદી સાલેહ ભાઈસાહેબ સફીયુદ્દીનનું બદરી મહેલનું રહેઠાણ જોયું હશે તે તેમનાં કરકસર અને સાદાઈની દૃઢપણે બહાલી આપશે. હાં, ઇબ્રાહીમ ભાઈસાહેબ અને સાલેહ ભાઈસાહેબ જ્યારે ત્યાં રહેતા હતા ત્યારે બાદરી મહેલ આજના જેવો સોનેરી ગઢ નોહતો. એ લોકોનું રસોડું એ જમાનાને અનુસાર જરા પણ આધુનિક નોહતું – લગભગ મુંબઈની ચાલ જેવું. તેમના મૃત્યુ પછી,બદરી મહેલ ને બુરહાનુદ્દીન મૌલાના શેહઝાદા દ્વારા આજે છે તે માં રૂપાંતરિત કરવામાં આવીયો હતો. તેઓએ ખરેખર બન્ને ભાઈઓના રહેથાણને જમીનદોસ્ત કરી ફરી બાંધ્યાં. દાવતની પાસે આજે જે કંઈ પણ અસ્કયામત છે તેના એક એક પછસા માટે અપણે ઇબ્રાહીમ ભાઈસાહેબની ખીદમત નો આભાર માનવો જોઈયએ. પરંતુ કેવી રીતે આપણે આ માણસનું નામો નિશાન સાંભલ્યું નથી? તેઓ એસ.કે.ક્યું. ના સસરા હતાં, આનાથી વધારે ખુલાસોની જરૂર નથી.

જે લોકોએ સૈફી મહેલમાં બુરહાનુદ્દીન મૌલાનાં રહેથાણને અંદરથી જોયું છે તે જાણે છે કે તે કેટલું કરકસરિયું અને સામાન્ય હતું. તેમના પિતા અને કાકાઓ જેવું. બુરહાનુદ્દીન મૌલા એટલા કરકસરિયા હતાં, કે જ્યારે સૈફી મહેલમાં નાના બાળકો રમતા હોય – ખાસ કરીને ઉપલો ૩માળ ઉપર તેમના રહેથાણની બાજુના મોટો ઓરડામાં – તીયારે યાદ છે કે જ્યારે તેઓ તેમના રહેથાણ ઉપર આવતા અને કોઈ વીજળીનો બલ્બ જલતો હોઈ તો બાલકોને એ બંધ કરવાનું કહેતા.

એસ.ટી.એસ અને ઇબ્રાહીમ ભાઈસાહેબના સમયમાં લગભગ દરેક એસ.ટી.એસ ના સદસ્યના નામ ઉપર શેયરમાં રોકાણ હતું. પછી આવ્યાં મુફ્દલ ભાઈસાહેબ, મહાન નાણાકિય નિષ્ણાત.તેઓએ સૈફી મહેલમાં બધાંને જબરદસ્તી - વિધવાઓ જે દવા ખરીદવા માટે શેયરની

આવક ઉપર આધાર રાખતી – તેઓ એ શેયર વેચવા પડ્યાં કારણ કે- તેને એમ સમજાવાનું સરૂ કર્યું કે – “હરામ છે”! હવે તમે જાતે જ ખાલી જગ્યા પૂરો કે પછી શું થયું અને હાજર દિવસ સુધી શું થઈ રહ્યું છે.

સૈફી મહલ ની અંદર ની વાતો.

મુનાફિક શહેઝાદા. લેખ ૧૩ તા.૨૪/૧૨/૧૪

સૈયદના અબ્દુલકાદરનજમુદીનના સૌથી નાના શહેઝાદા અબ્દુલાહ હકીમુંદીન હતાં. તેઓ ઉરતાલીસયા હતાં – જેઓ માનતા હતા કે સૈયદના નજમુદીન ઉપર નસ કરવામાં આવી ન હતી અને તેથી, ઇમામ ઝુહુર થયાં હતા. જ્યાં સુધી સુરતમાં કુબ્બાનું જીર્ણોદ્ધાર થયું નોહતું ત્યાં સુધી શહેઝાદા અબ્દુલાહ હકીમુંદીનની કબર કુબ્બાના અંદર હતી. તેમનો ઇતિહાસ જાહેર પ્રજામાં ક્યારે પણ વ્યાપક રીતે જાહેર કરવામાં આવ્યો નહિં – કારણ તેઓ શહેઝાદા હતાં.તેઓ ઘણા શક્તિશાળી અને સ્પષ્ટવક્તા હતાં. સૈયદના નજમુદીનના વફાત પર બડાઈ હાંકવાં લાગ્યાં કે પોતે કેવી રીતે સૈયદના એ કરેલી નસને બદલી નાંખતે અગર સૈયદનાનું મૃત્યું નજદિક છે તેની તેમને જાણ હોતે! આ દૃષ્ટતા હતી, જે આ મહાન, જગ જાહેર અને સમૃદ્ધીથી ભરપૂર સૈયદના નજમુદીન મૌલાના યુગમાં અંત સુધી જામમ રહ્યો.

શહેઝાદા અબ્દુલાહ હકીમુંદીનના શહેઝાદાઓ માંથી એક શહેઝાદા ફઝલ ભાઇસાહેબ હતાં.તેમને ૩ દીકરીઓ અને ૧ દીકરા હતાં. દીકરીઓ માંથી એક દીકરી આતેકા બેનસાહેબા હતાં. આતેકા બેનસાહેબાના દીકરી અમતુલ્લા આઇસાહેબા, બુરહાનુદીન મૌલાના બૈરો. તેથી મુફદલ ભાઇસાહેબ અબ્દુલાહ હકીમુંદીનના સગામાં થયાં. અબ્દુલાહ હકીમુંદીન મુફદલ ભાઇસાહેબના ત્રજી પેઢીનાં નાનાજી થાય. કેવી રીતે ઇતિહાસ ફરી પાછો પ્રગટ થાય છે.

સૈફી મહલ ની અંદર ની વાતો.

કાઇદઝોહર ભાઇસાહેબના દીકરાનો નાશ . લેખ ૧૪ તા.૨૬/૧૨/૧૪

બુરહાનુદીન મૌલા અને બું સાહેબા અમતુલ્લા આઇસાહેબાની ખુશી હતી કે મુફદલ ભાઇસાહેબના દીકરી ઉમ્મૈહાનીની શાદી કાઇદઝોહર ભાઇસાહેબના દીકરા તાહેર ભાઇસાહેબ ઇઝુદીન સાથે થાય.પરંતુ ઉમ્મૈહાની ડો. મોઇઝ ના દીકરા અબ્દુલકાદરથી મોહિત હતા. તેથી ભલે મૌલાની ખુશી હતી પણ ઉમ્મૈહાનીએ આજ્ઞાનું પાલન ન કરીને અબ્દુલકાદર સાથે શાદી કરી. અન્ય લોકો માટે મૌલાની ખુશીને ખુબજ મહત્વ આપવું – આ તે કેવું બેવડું ધોરણ!

આ બનાવથી દુર્ભાગી તાહેર ભાઇસાહેબ ઇઝુદીન માનસિક રીતે ભાંગી પડ્યાં.તેઓ ઉમ્મૈહાનીને દિલથી ચાહતા હતાં અને બીજુ કોઈ તેની સાથે લગ્ન કરે એ તે બરદાસ્ત કરવા તૈયાર ન હતા – તેઓએ અબ્દુલકાદરને હકીકતમાં ધમકી પણ આપી હતી – અને તેથી કાઇદઝોહર ભાઇસાહેબે તેમને દૂર લંડન ઇલાજ માટે મોકલી દીધા હતાં. આ કારણ સર બન્ને ભાઇઓ વચ્ચે પ્રચંડ ફાટ પડી - કાઇદઝોહર ભાઇસાહેબ અને મુફ્દલ ભાઇસાહેબ – અને જોકે ઊંડિ ફાટ કાઇદઝોહર ભાઇસાહેબના પત્ની શમીના બાઇસાહેબા અને મુફ્દલ ભાઇસાહેબના પત્ની ઝોહરતુસસરફ બાઇસાહેબા વચ્ચે પડી. આ બે પત્નીઓ વચ્ચેની જગજાહેર ફાટ હજુ વધું ઘહેરી બની.

બુરહાનુદીન મૌલાને તાહેર ભાઇસાહેબ ઇઝુદીનથી ઘણી મોહતી અપેક્ષાઓ હતી. બુરહાનુદીન મૌલાએ તેમને ઇજ્તિહાદ, અરબી તથા ફુન્યવી તાલીમ માટે પણ મોકલ્યાં હતાં. તેઓ સંપૂર્ણ રીતે શિક્ષિત છે જે મુફ્દલ ભાઇસાહેબના કોઈ પણ બાળકો નથી. પરંતુ ભોલા તાહેર ભાઇસાહેબ ઇઝુદીનને, મુફ્દલ ભાઇસાહેબ અને તેમના પત્નીની ઈર્ષ્યાએ વિનાશ તરફ ધકેલી દીધાં.

સૈફી મહલ ની અંદર ની વાતો.

બુરહાની મંઝીલમાં એક વધું ભોગ . લેખ ૧૫ તા.૨૬/૧૨/૧૪

કાઇદઝોહર ભાઇસાહેબના બીજા પુત્ર જેણે તેનું સ્થાણ બતાવી દેવામાં આવ્યું તે છે ઇબ્રાહિમ ભાઇસાહેબ- તેઓ ફાતેમા બાઇસાહેબા, એસ.કે.ફયુ ના દીકરી સાથે પરણેલા છે/હતા. દરેકને યાદ છે કે નજફની મસ્જિદની યોજના અને કરબલાનાં ભંડોળ એકત્ર કરવાં માટે વિશ્વભરમાં ઇબ્રાહિમ ભાઇસાહેબ જતાં. લગભગ બધુંજ પાયાનું કાર્ય ઇબ્રાહિમ ભાઇસાહેબે કર્યું. તેમણે આયોજન અને તૈયારી પાછળ નજફ અને કરબલા વારંવાર ગયા. અચાનક તેમને વીઝા કે બીજા કોઈ કારણે ઇરાક છાડવું પડ્યું. મુફ્દલ ભાઇસાહેબના દીકરાએ એ પ્રવેશ કર્યો. તેઓએ ઇબ્રાહિમ ભાઇસાહેબે જે પુર્ણ કર્યું હતું તે તાબામાં લીધું અને તેના પિતરાઈ ભાઇને બાજુએ મુકી દીધા – જેમકે તેમણે કંઈક ખોટું કર્યું હોય અને તેથી તેઓ ને લઈ લેવું પડ્યું.

આ સ્થાણ બતાવી દેવું પ્રસંગ એવી રીતે ઉકેલવામાં આવ્યો કે જેનાથી ઇંગલાન્ડ ના હેનરી ૮ પણ ચકિત થઈ જાય. આ ભલો માણસ ઘણા સમય સુધી ગંભીરપણે દુભાયો અને નિરુત્સાહી થયો અને લગભગ ઘણો સમય લંડનમાંજ વીતાવ્યો. કોઈને નવાઈ લાગશે શાંમાટે – તેમના માટે નિરંકુશ રાજ્યકર્તાથી સંપૂર્ણપણે છેડો ફાડી નાંખી આનંદીત જીવન વીતાવવાની ટક હતી –

તેઓએ માત્ર તેમના પત્નીની વાત ન સાંભળી અના કુત્બી સાથે ન થયા.હકીકતમાં,બેકર્સફિલ્ડમાં તેમના પોતાના બાળકો હતા. તેઓ તેમના પત્ની અને બાળકો સાથે સુલેહ, સુખી અને શાંતિપૂર્ણ જીવન વીતાવી શકતે.

સૈફી મહલ ની અંદર ની વાતો.

તમે તેમને હરાવી નથી શકતા, તેમના સાથે જોડાઈ જાવ. લેખ ૧૬ તા.૨૬/૧૨/૧૪

શરૂઆતથીજ ઝકીઉદ્દીનો નજમુદ્દીનોથી, ભયભીત અને ઇર્ષ્યાળુ હતાં. ઝકીઉદ્દીનો એટલે અબ્દુલ તૈયબ ભાઈસાહેબ ના ફરઝંદો અને અપણે બધા જાણીએ છે કે નજમુદ્દીનો એટલે કોણ? હંમેશા બધી બાબત માં આગળ પડતા, હંમેશા દરેક વ્યક્તિને પછાડવી - ખાસ કરીને ઝકીઉદ્દીનોને - નજમુદ્દીનોને દેવ બનાવી દેવામાં આવેલા અને એજ રીતે ઝકીઉદ્દીનો સાથે ઇર્ષ્યા અને તિરસ્કાર. યુસુફ ભાઈસાહેબના દીકરા, દીકરીઓ - ભણેલા હતાં - ભાઈસાહેબ જેવાં, જે ઓરડામાં તમે હોવ તેનાથી પણ મોટા, આખાબોલા અને હજારો દ્વારા દેવ બનાવી દેવાયેલા. જ્યારે ઝકીઉદ્દી ભાઈઓ - તેમને ૨ માતાઓ હતી જે કોઈ રીતે પણ યુસુફ ભાઈસાહેબની પત્નીના, રાણી જેવા વ્યક્તિત્વની બરોબરમાં આવી ન શકે, ની ઘણી વખત ખાનગીમાં હાંસી ઉડાવામાં આવતી, કસરે આલી ઓથીજ નહિં પરંતુ બેઇતે ઝૈની અને કોથાર પણ. જુઓ રાજવંશનો સજરો

<http://www.familyecho.com/?p=N8EH3&c=v3nlpz7k2a&f=980388480567067672>

યુસુફ ભાઈસાહેબ નજમુદ્દીન તેમના સાવકા ભાઈ અબ્દુલ તૈયબ ભાઈસાહેબની સરખામણીમાં ઘણું વધારે અને જીવન કરતાં પણ મોટું વ્યક્તિત્વ ધરાવતા હતાં. અબ્દુલ તૈયબ ભાઈસાહેબ યુસુફ ભાઈસાહેબથી સંપૂર્ણ વિરુદ્ધ હતાં. અબ્દુલ તૈયબ ભાઈસાહેબ નમ્ર, મુદભાષી અને શરમાળ હતાં. જ્યારે યુસુફ ભાઈસાહેબ ઇજીપ્તમાં ગુજરી ગયા, ત્યારે એવું વાતાવરણ બન્યું જાણે સૈફી મહલ ઉપર આસમાન તુટી પડ્યું હોય. તેમને ઉત્તમ ખિતાબથી નવાજવામાં આવ્યાં. જેવાં કે અલ-મુકદ્દસ નજમુદ્દીન સાહેબ.પણ જ્યારે અબ્દુલ તૈયબ ભાઈસાહેબ,ફરેમોનત, કેલીફોરનીયામાં ગુજરી ગયાં ત્યારે ભાગ્યે જ ત્યાં કોઈ હતું. તેમ છતાં તેમની અંતિમવિધિ માટે ઇદરીશ ભાઈસાહેબને મોકલ્યાં. ખાસ કરીને વજીરા આઈસાહેબા ના અગાઉના લગ્નથી થયેલા ફરઝંદો, સાવકા કાકાજી સાહેબને માનસન્માન ન મલવાથી ખફા હતાં. કેટલાકે સીધેસીધા સવાલ ઉઠાવેલા કે સામાટે તૈયબ ભાઈસાહેબ અલ-મુકદ્દસના ખિતાબથી નવાજવામાં ન આવ્યાં?

પછી, નજીક હાજર સમયે, વસ્તુઓ બદલવાની શરૂઆત થઈ. બેહુલ ઝકીઉદ્દીન જે તૈયબ ભાઈસાહેબના ફરઝંદ હતાં, તેમના ફરઝંદ મુસ્તનસીર કૌસરઅલી નજમુદ્દીનની દીકરી સાથે પરણેલા. ઝકીઉદ્દીનનોની હારની જાણે એક ઊંડી છાપ પડી ગઈ હતી. એક રસિક ઘટના એ હતી કે શમીના બાઈસાહેબા, કાઈદઝોહર ભાઈસાહેબના પત્ની તૈયબ ઝકીઉદ્દીન ભાઈસાહેબના દીકરી છે અને ઝકીઉદ્દીનનોની બહેન, તેથી - વારેવારે અને ક્યારેક કલ્પી ન શકાય એ રીતે- કાઈદઝોહર ભાઈસાહેબ અને સાલા ઓને એક બીજાને ટેકો મલતો રહ્યો.

મુદરેકા ઝકીઉદ્દીન, જાણીતા વકીલ જેઓ એકદમ યુવાન વયે અચાનક હૃદયરોગનો હુમલોથી ગુજરી ગયાં, તેમની દીકરીના લગ્ન અલ-અનવર બદરુદ્દીન - જોહરતુલ મજદ અને ઇદરીસ ભાઈસાહેબના ફરઝંદ - સાથે થયેલાં. અલ અનવરના કોઈ અંગત મુદ્દાઓ હતા જે તેમની નવી પત્નીને પસંદ નોહતાં. આ નવા પત્નીને ઇદરીસ ભાઈસાહેબના ઘરની અંગત વાતો બહાર ન જાય તેથી દુર રાખવાં જોહરતુલ મજદે તોહમત મુકી કે કોથારના કોઈ જવાન માણસ સાથે આડ સંબંધો છે અને વધુમાં ચોરીના પણ આક્ષેપ મુકવામાં આવ્યાં! આ ભોલી છોકરી ને તલાક આપવામાં આવી અને બાપ મુદરેકાના ઘરે મોકલી દેવામાં આવી. અલબત્ત, કોઈ પિતા આવું અપમાન અને આવી પીડા સહણ કરી શકે નહીં અને બીયારા માણસ ઘરે સોફા પર બેથેલાં ત્યારે હૃદય હુમલાથી મૃત્યુ પામ્યા.

સૈફી મહલ ની અંદર ની વાતો.

મુફ્દલ ભાઈસાહેબના ઉગ્ર વ્યવહારનો એક વધું ભોગ. લેખ ૧૭ તા.૨૯/૧૨/૧૪

બેઠતે જઈનીનો સદ્સય અને જામીયાના પદવી ધારક, દાઉદી બોહરા પંથ છોડીને ખ્રિસ્તી બની ગયા - મુફ્દલ ભાઈસાહેબના ઉગ્ર અને સમાધાનની કોઈ તક ન રહે એવા વ્યવહારથી એક વધું ભોગ - ડો સકીના જમાલુંદીન જેઓ મુકાસીર એ દાવત સૈયદી ઇસહાક જમાલુંદીનના પર પોત્રી અને બેકર્સફિલ્ડના અગાઉના આમીલ શબ્બીર જમાલુંદીનના દીકરી છે તેઓએ ખ્રિસ્તી માણસ સાથે લગ્ન કરી લીધાં. પ્રેમ અને સમજ સાથે ફરી પાછા દાઉદી બોહરા સમાજમાં લાવવાના બદલે મુફ્દલ ભાઈસાહેબે સકીનાની માં ને ફરમાન કર્યું કે સકીના સાથેના તમામ સંબંધો કાપી નાંખે અને તેને પછસા મોકલવાનું બંધ કરે. સકીનાને કઈ પછસાની જરૂર નહોતી. તેઓ પોતે ડૉક્ટર હતાં. આ મુફ્દલ ભાઈસાહેબની સમજશક્તિ માટે ઘણું છે.

શબ્બીર જમાલુંદીન ઘણા સમયથી બેકર્સફિલ્ડના આમીલ હતાં અને તેમના પત્ની ડૉ ઉમેઈમા જમાલુંદીન સાથે સાહસ કરીને ઘણા મુમેનીનોને ત્યાં વસાવ્યાં. બેકર્સફિલ્ડમાં વપરાતુ મરકઝ

હકિકતમાં જમાલુંદીનોનું અગાઉનું નિવાસ સ્થાણ હતું. શબ્બીર ખૂબ જ કાબીલ એકાઉન્ટન્ટ હતા અને આમીલ રહ્યાં ત્યાં સુધી, જ્યાં સુધી મુક્કરમ, કાસીમ ભાઇસાહેબ હકીમુદ્દીનના દીકરા બેકર્સફિલ્ડમાં સ્થળાંતર થયાં. કાસીમ ભાઇસાહેબે મુક્કરમને બેકર્સફિલ્ડના આમીલનો તાજ પહેણાવ્યો તે સમયથી બીયારા શબ્બીરની તબીયત બગાડતી ગઇ ત્યાં સુધી કે એક સમયે તેઓ સંમ્પૂર્ણ પથારી વસ થઇ ગયાં. અલબત્ત નાની સકીનાને જરૂર આઘાત લાગ્યો હશે તેના સન્માનિત પિતા તરફ ખરાબ વર્તન થી.

ડૉ ઉમેઇમા ફાતેમા આઇસાહેબાના - પહેલા લગ્નથી - પરપોત્રી હતાં (એસ.ટી.એસ.સાથે લગ્ન થયા પહેલાં). ડૉ ઉમેઇમા ઝોહરતુસ શરફ સૈફુદ્દીનના સાવકા પિતરાઈ હતાં. યોગાનુયોગ મુક્કરમના પત્ની, મારીયા પણ ફાતેમા આઇસાહેબાના - પહેલા લગ્નથી - પરપોત્રી હતાં. મારીયાના માં લુબેઇના, જે નોમાન નૂરુદ્દીન - પહેલાના ઓરેન્જ કંટરી ના આમીલ - ના ભૂતપૂર્વ પત્ની છે. કેલિફોર્નિયા અને શિકાગોના ભૂતપૂર્વ નિવાસી.

શબ્બીરના મૃત્યુ બાદ, ડૉ ઉમેઇમાએ સામાન્ય માણસ સાથે લગ્ન કર્યાં. સકીના થોડા સમય માટે જામીયા ગયા અને પછી એક હ્યુસ્ટનના સામાન્ય માણસ સાથે લગ્ન કરી લીધાં. - નુરુદ્દીન યમાનીના દીકરા - જેણે ડૉ ઉમેઇમા સાથે ખરાબ રીતે વ્યવહાર કર્યો. છેલ્લે તેનીએ બધુંજ છોડી દીધું. જામીયાનું શિક્ષણ પણ અને ધર્માન્તર કરી ખ્રિસ્તી બની ખ્રિસ્તી માણસ સાથે લગ્ન કર્યાં. તેઓ હવે સકીના પેયન તરીકે ઓળખાય છે.

સવાલ જવાબો.

સ.૧ તમે વંશાવળી મુકી શકો? જેથી સૈફી મહેલના એક બીજાનાં સંબંધો જોડી શકાય અને દાઇના કુટુંબમાં થતા પક્ષપાતની જાણકારી મલી રહે?

જ.૧ સૈયદના તાહેર સૈફુદ્દીનના ૪ આઇસાહેબા અને તેમના ફરઝંદો.

(૧) હુસેના આઇસાહેબા. એસ.એમ.બી. જ્યારે બાલક હતા ત્યાંરે જ ગુજરી ગયેલા: તે પછી તેમની સાર સંભાલ ફાતેમા આઇસાહેબા એ કરી.

-- સૈયદના મોહંમદ બુરહાનુદ્દીન (રા)

-- અસમા બા.સા.* (તાહેર ભા.સા. સાથે પરણેલા) - દીકરા મોઇઝ ભા.સા. એસ.કે.ક્યુ સાથે. - મોહ્યુદ્દીન કુટુંબ.(હ્યુઝેઇશ ભા.સા. મોહ્યુદ્દીન એસ.એમ.બી.ના દીકરા નહીં).

-- હુસેના બા.સા. - દીકરાઓ: અબીઝર,અબી અલી, અબીલ ફઝલ (કટ્ટર ઇજિપ્શીયન

મુફ્ફલી), અબી તમીમ,અબદે અબી તાલીબ, તાહેર – ઘણું મોટું હુસામુદ્દીન કુટુંબ.

(2) વજીરા આઇસાહેબા

-- તૈયબ ભા.સા.* - દીકરાઓ: તુરાબ(યુ.એસ.એ ના રાજા), ખીદર, બેહલુલ(યુ.એસ.એ ના નવા રાજા),અદનાન, મુદરેકા, જુન, મુસતાલી; દીકરીઓ: બિનમહત્ત્વનું - ઘણું મોટું જકીઉદ્દીન કુટુંબ.

-- ઇસમાઇલ ભા.સા.* - દીકરાઓ: કુરેશ, મુરતાઝા, શામોઇલ - શેહાબુદ્દીન કુટુંબ.

(3) ફાતેમા આઇસાહેબા

-- યુસુફ ભા.સા.* - દીકરાઓ: જુજર, નામચીન બદરૂલ જમાલી, સૈયદુલ ખૈદર,કૌસરઅલી; દીકરીઓ: જૌહરતુસરફ, મારીયા - મોટું નજમુદ્દીન કુટુંબ.

-- કાસીમ ભા.સા. - દીકરા: જગ જાહેર તાહા, મુકર્રમ - હકીમુદ્દીન કુટુંબ

-- અલીઅસગઇર ભા.સા. - બચ્ચાઓ નથી - કલીમુદ્દીન કુટુંબ.

-- મરયમ બા.સા. (યાહયા ભા.સા. ને પરણેલાં) - ઇઝીઉદ્દીન કુટુંબ.(કાઇદજોહર ભા.સા. ઇજુદ્દીન નહી) તૈઝુનના નાનીમાં)

-- ખદીજા બા.સા. * (દાવુંદ ભા.સા. ને પરણેલાં) - દીકરા: મુદર (સુરત આમીલ), લુવાઇ)ઇજ્જતના કદ્ર મુફ્ફલી) જમાલુદ્દીન કુટુંબ.(અમાર ભા.સા. જમાલુદ્દીન, એસ.એમ.બી. ના દીકરા નહિં).

-- શહેરબાનુ બા.સા. (ડોં ઇદરીસ ભા.સા. ને પરણેલાં) - દીકરી: - જોહરતુલ મજદ ઇદરીસ ભા.સા. ને પરણેલાં (એસ.એમ.બી. ના દીકરા) - ઝૈનુદ્દીન કુટુંબ - લંડન.

(4) આમેના આઇસાહેબા

-- હાતીમ ભા.સા.* - દીકરી કસઇ ભા.સા. ને પરણેલાં (એસ.એમ.બી. ના દીકરા), અમ્માર ભા.સા. (એસ.એમ.બી. ના દીકરા), અને અબ્દેઅલી ભા.સા.એસ.કે.ક્યું ના દીકરા) - હકીમુદ્દીન કુટુંબ - ઓક્સફર્ડ, ઇંગ્લેન્ડ.

-- સબ્બીર ભા.સા.- દીકરી: મુફ્ફલ ભા.સા. ના દીકરા અને કાઇદજોહર ભા.સા. ના દીકરા ને પરણેલાં - નુરુદ્દીન કુટુંબ

-- અબ્બાસ ભા.સા.- દીકરા: નજમુદ્દીન (આફ્રીકાના બનાવ પછી ઘણાં વર્ષોથી ભાગી ગયેલા), સૈફુદ્દીન (કદ્ર મુફ્ફલી), મોઇઝ, દીકરી તાહા હકીમુદ્દીન ને પરણેલાં - ફખરુદ્દીન કુટુંબ

-- સૈયદના ખુઝેમા કુતબુદ્દીન ત.ઉ.શ.(પત્ની બુસાહેબા સકીના આઇસાહેબા).

-- મોહમદુલ બાકીર - આફ્રિકા એપિસોડ પછી ગંભીર આરોગ્ય સમસ્યાઓ. ઘણા વર્ષો પહેલા ગુજરી ગયાં. એસ.ટી.એસ. ના સૌથી નાના પુત્ર. જમાલુદ્દીન કુટુંબ. (અમ્માર બા.સા.જમાલુદ્દીન એસ.એમ.બી ના દીકરા નહિં.)

-- અમતુઝ ઝેહરા બા.સા.(અબ્દુલ હુસેન) – દીકરી – દુર્ગાયા, લુલુઆ, જુમાના.

-- સીરીન બા.સા.(હાસીમ બા.સા. ને પરણેલા, સૈયેદી સાલેહ બા.સા.) – દીકરા: મુસ્તફા (વકીલ), કેઇજાર.

-- ઝૈનબ બા.સા.(અબ્દુલ કાદર બા.સા.* ને પરણેલા) – દીકરા: લમક, માઅદ, દીકરી: દુર્રત (કુખ્યાત સૈયદુલ ખેર ને પરણેલા) હરવા.

-- ફાતેમા તઉસ સુગારા બા.સા.(ઝોએબ બા.સા. ને પરણેલા) દીકરા ઉબેઇ, અલ-અઝહર, અલ-અકમાર.

* ગુજરી ગયા.

સ.૨ તમે વિગતવાર "આફ્રિકા પ્રસંગ " ઉપર જાણકારી આપી શકો?આ વિષય કોઈ સુસંગત વાર્તા હોય તેમ લાગે છે અને તે આ મતભેદમાં કેન્દ્રીય વળાંક લાગે છે.

જ.૨ ત્યાં ખરેખર કોઈ પ્રસંગ નોહતો. હકીકતમાં માત્ર પ્રસંગ એ હતો કે નજમુદ્દીનનું કુટુંબ અને હેબતુલ્લાઓ મલી ગયા અને એસ.કે.ક્યું. ના બારામાં વ્યર્થ નિવેદનો કર્યા. તેમ છતાં હેબતુલ્લાઓએ એસ.કે.ક્યું.ને દેશપાર કરવાની પણ કોશીશ કરી. એસ.એમ.બી.એ આ બનાવને ડાબી દીધો એટલા માટે કે એસ.ટી એસ.ના સમયમાં આવોજ બનાવ એક આફ્રિકાના વગવાળા કુટુંબ કરીમજી સાથે બનેલો અને અંતે આ કુટુંબે દાવતજ છોડી દીધી. જ્યાંરે એસ.એમ.બી.એ આ વિષય ઉપર બોલવાનું બંધ કર્યું તે પછી એસ.કે.ક્યું એ આ વિષય ઉપર કોઈ પણ ઉલ્લેખ કર્યો નહિ. ફાતેમા આઇસાહેબાના કુટુંબીઓએ કહ પણ ન હોવા છતાં પહાડ ઉભો કર્યો અને જે પરિસ્થિતી પર દોરવી લાવ્યાં તે આપણે

જોઈ રહ્યાં છે.

- સ.૩ તમે કે બીજુ કોઈ જાણો છો કે સૈયદના બુરહાનુદ્દીન મૌલાના પોત્ર કે પર પોત્રનું ઘણા પછસા સાથે અપહરણ થયું હતું કે ગુમ થયા હતાં? આ ઘણી જુની વાત છે અને મુંબઈ પોલીસ આ કેસનો ઉકેલ લાવી શકી નહિ અથવા પૈસાથી દબાવી દેવામાં આવ્યું હતું.
- જ.૩ હાં, તેઓ બુરહાનુદ્દીન મૌલાના પર પોત્ર છે, ખદીજા બાઈસાહેબાના પોત્ર, મુસ્તફા, જે પોતાનું નામ બદલીને અબ્દુલકાદર રાખ્યું છે. આ બીજો મુફ્દલ ભાઈસાહેબનો ભ્રમીત એક જામીયાનો છાત્ર જેને બહારી દુનિયા વીંધે કંઈ પણ જાણકારી નથી.
- સ.૪ અમે પૂછતા રહ્યાં છે કે સૈયદના બુરહાનુદ્દીન મૌલા તેમના માં વીશે ક્યારે પણ બોલ્યાં નથી? તેના ઉપર તમે કંઈ પ્રકાશ પાડશો? તેઓ કોણ હતા અને શા માટે તેના અંગે કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવતો?
- જ.૪ તેમણે તેમના માતા વિશે ક્યારેય વાત ન કરી ,કારણ કે તેઓ વિનયશીલ હતા – અને અપણે સઘલા એ જાણીએ છે. ઉપરાંત તેઓ તેમનાં માતાને જાણતાં નોહતાં કારણ કે હુંસૈના આઈસાહેબ ગુજરી ગયા ત્યારે તેઓની ઉંમર ઘણી નાની હતી. તેઓની ઉંછેરની ફાતેમા આઈસાહેબા એ કરી, તેમના બચ્ચાઓ અસમા બાઈસાહેબા અને હુંસૈન ભાઈસાહેબ સાથે (બુરહાનુદ્દીન મૌલાના મુકાસીર).
- સ.૫ નજમુદ્દીન (અબ્બાસ ભાઈસાહેબ ના દીકરા) ની શુ વાર્તા છે જે આફ્રિકા ના બનાવ પછી ભાગી ગયાં? ત્યારે તેઓની ઉંમર કેટલી હતી? તેઓ સામાન્ય લોકો સાથે રહે છે, કે પછી તેમની કુશલતા અને ઠેકાણા વીશેની કોઈ જાણકારી નથી?
- જ.૫ તેઓ કાઈદજોહર ભાઈસાહેબ ની નાણાકીય સહાયથી ઉચ્ચ અભ્યાસ માટે યુ.એસ.એ. જતા રહ્યાં - આ તેમના માટે હાનિકારક કૃત્ય માંથી બહાર જવા નો માર્ગ હતો. ત્યાર પછી તેઓ ક્યાં છે તેની ખબર નથી. તેમ છતાં અબ્બાસ ભાઈસાહેબ હજુ સુધી એમના સાથે સંપર્કમાં છે અને એક પિતા તરીકે સંબંધ તોડયા નથી - જે અપણી અપેક્ષા થી વિપરીત છે. તેમણે તેમના પિતા ની મુલાકાત લેવા સૈફીમહેલ માં આવતા જોવામાં આવેલા. આ આમેના આઈસાહેબા અને ફાતેમા આઈસાહેબા ના બાળકો વચ્ચે તફાવત છે: પહેલાં ઉલ્લેખ કરેલો જુથ ઘણા વધારે ઉદારમતવાદી તેમના નજદીકના કુટુંબીઓ

સાથે છે, જ્યારે વસ્તુસ્થિતિ જોતાં પછી ઉલ્લેખ કરેલો જુથ કટ્ટર - મુફફદલ ભાઈસાહેબ જેવા - બસ આગમાં ફેંકી દો. આ પ્રતિબિંબિત કરે છે મોટા “ઇખલાસ” ની સેખી મારતા માણસની માનસિકતાની. તૈઝુન શાકિર એક ઉત્તમ ઉદાહરણ છે, ફાતેમા આઈસાહેબા ના બાળકોને કેવી રીતે ફેંકી દેવાયા છે.

સ.૬ તમે સૈફીમહેલ વિશે થોડો પ્રકાશ પાડી શકશો. જી.એમ. ભાઈ અને બીજાઓ એ લખેલું કે રોકડા અને સોના થી ભરેલો એક ઓરડો છે. શું આ સાચી વાત છે?

જ.૬ નહિં કે હું પરિચિત છું 😊. સૈફીમહેલ - આ ઇમારત આખાનોજ - હવે વિધવાઓ અને બદરુલ જમાલિ દ્વારા કબજો કરવામાં આવેલ છે.બધાજ ૩ માલા ઉપર મોટા ઓરડાઓ છે. રેહવા લાયક જગ્યાં બહુ નાની છે.

સ.૭ હું આશા રાખુ છું કે તમે કસરે-આલી અને બેતે-જેઇની, સામાન્ય મુમેનીન/મુમેનાત ની સરખામણીમાં કેવી રીતે જીવન જીવે છે એ વિશે વધુ કહેવાનું ચાલુ રાખશો.

જ.૭ કસરે-આલીના મોટા ભાગના સૈફીમહેલમાં રહેતાજ નથી. ત્યાં પરીસરમાં બે અન્ય ઇમારતો છે જે એસ.ટી.એસ. અને એસ.એમ.બી.ના શેહજાદા અને શેહજાદીઓની પોતાની માલિકીની છે. અલ-અઝર ઇમારત એસ.ટી.એસ.એ બંધાવેલી જેમાં ફ્લેટ એસ.ટી.એસ.ના શેહજાદા અને શેહજાદીઓના પોતાની માલિકીના છે. અહિંજ એસ.કે.ક્યું નો ફ્લેટ છે.

બુરહાની મહેલ પોતાની માલિકીની ઇમારત છે જેમાં એસ.એમ.બી.ના શેહજાદા અને શેહજાદીઓના પોતાની માલિકીના ફ્લેટ છે. બીજા કસરે-આલીના સભ્યો મુંબઇ તથા તેની આસપાસ ફ્લેટમાં રહે છે અથવા પરદેશ માં. ઘણા ખરા અમાલત ઉપર.

સ.૮ તમે જાણો છો, કેટલા શેહજાદા અને શેહજાદીઓ જામેઆમાં શિક્ષણ લે છે, તે લોકો જામેઆમાં જાય છે કે અંગ્રેજી શાળા માં જાય છે.

જ.૮ એસ.ટી.એસ. અને એસ.એમ.બી.ના કોઇ પણ શેહજાદા અને શેહજાદીઓ જામેઆમાં ગયાં નથી. હકીકતમાં મુતલકા પહેલાં સૈફીમહેલમાંથી કોઇને પણ જામેઆમાં જવાની પરવાનગી આપવામાં આવતી નહિં. તેઓ બધા દીની ઇલ્મ સીધા શેહજાદા અને શેહજાદીઓ પાસેથી મેળવતા. ઘણી વખત એસ.ટી.એસ.અને એસ.એમ.બી. પાસેથી

પણ, અને ઘણી વખત કોથારના મૌઅલીમ (જામીયાના). દુનિયાના શિક્ષણ માટે એસ.ટી.એસ. શરૂઆત નાં વરસોમાં શિક્ષક રાખતા જે ઘરે આવી જુદા જુદા વિષય સીખવતા. પછીના વરસોમાં બાલકો નિયમિત શાળાઓ / કોલેજોમાં જતા. એસ.એમ.બી.ના બાલકો પણ એમજ કરતાં. માત્ર છેલ્લા એક દાયકાથી કે વધારે બધાજ જ યુવાનો – પુરુષ અને સ્ત્રી – ને ભારપૂર્વક જામીયામાં જવાની સલાહ આપવામાં આવે છે.

સ.૯ છેલ્લા ૨ લેખોમાં મૌલાના બુરહાનુદ્દીનના તમે વખાણો કર્યા છે, પણ શું મૌલાના બુરહાનુદ્દીન સૈફીમહેલ ના કામકાજ વિશે જાણતા હતા? સૈફીમહેલ, કસરે-આલી અને બેતે-જઇના સભ્યો હકિકતમાં કોણ નિયંત્રણમાં હતાં?

જ.૯ બેતે-જઇની સૈફીમહેલમાં રહેતા નથી, તેઓ ઘણું કરીને સ્વતંત્ર છે અથવા અમાલત ઉપર છે, અને સામાન્ય જીવન જીવે છે. કસરે-આલી એસ.ટી.એસ.ના ફરઝંદો છે, બેતે-જઇની સૈયદના તૈયેબ ઝૈનુદ્દીનના ફરઝંદો છે. અલબત્ત, બુરહાનુદ્દીન મૌલા સંપૂર્ણપણે વાકેફ હતા પરંતુ મે પહેલેથી જ મારા અગાઉના લખાનોમાં આ સંબંધિત સ્પષ્ટતા આપી છે.

સ.૧૦ કેવી રીતે સગલાને હફતા (વજીફા) આપવામાં આવે છે. આ મુમેનીનને તેમના વાજેબાત કેવી રીતે વપરાય છે તે જાણવામાં મદદરૂપ થશે.

જ.૧૦ આ સવાલ કોથાર અને બદરીમહેલનાં આંતરિક વર્તુળ સાથે સંકળાયેલ છે. હું ફક્ત કસરે-આલી અને સૈફીમહેલ સંબંધિત માહિતી આપુ છું. હું આ અન્ય ગુપ્ત વાત જાણનારાઓ માંથી નથી.

સ.૧૧ એક સવાલ હકનીવાત નાણાં ના રોકાણ બાબતમાં. શેર “હરામ” જાહેર કરવામાં આવ્યું છે તો નાણાં નું રોકાણ શેરનાં બદલામાં ક્યાં કરવામાં આવે છે?

જ.૧૧ હું માનું છું કે મોટા ભાગના લોકોએ એક વિકલ્પ તરીકે શેરમાં – મુફદલ ભાઇસાહેબ થી છુપાવી ને – અથવા જમીન જાગીરમાં રોકાણ કર્યું છે. મોટા ભાગના સૈફીમહેલના વડીલો પુરા મૂર્ખ નથી – નાણાકિય બાબતમાં - તેને સાંભળવા માટે. પરંતુ તેઓ એ યુવા પેઢી ને તે જાહેર કર્યું નથી.

તમારો આભાર, મૂલ્યવાન માહિતી શેર કરવા માટે. મારો એક સવાલ છે... બધાએ સ.૧૨ સાંભળ્યું છે કે વાંચ્યું છે, નસ સાક્ષી વગર મૌખિક કરવામાં આવી હતી પરંતુ મને ગૂંચવણમાં નાખે એવી વાત એ છે કે તે બાબતે કોઈ નક્કર પુરાવાઓ દેખાતા નથી અન્યથા અદાલતમાં રજૂ કરવામાં આવ્યાં હોત. (કે પછી છે?)....શા માટે બુરહાનુદ્દીન મૌલાએ પુરાવા આપીયા નહિં હોય અથવા એસ.કે.ક્યું એ સમયમાં વપરાતા લેખન / વિડિયો / ઓડિયો ટેપ જેવા પુરાવા માટે અરજી કરી નહીં હોય? સલામ.

જ.૧૨ જો અપણે બુરહાનુદ્દીન મૌલા ઉપર જરાપણ વિશ્વાસ હોય તો –હું વિશ્વાસથી અને નિઃશંક માનીશ કે જે કંઈ કરવું જાઈતું હતું તે બધુંજ એસ.કે.ક્યું એ કર્યું છે. અપણે તેઓ પાસેથી એ અપેક્ષા ન રાખી શકો કે બધુંજ જાહેર કરી દે. અગર અપણે માઝુનના રૂતબા વીષે ભરમાવવામાં ન આવ્યાં હોત તો અપણામાં આ અવિશ્વાસ ન હોત જે આજે છે. અપણે ફક્ત માઝુનના શબ્દ ઉપર વિશ્વાસ કરતે, અને શેહઝાદાઓ એ પણ – ખાસ કરીને મુફ્દલ ભાઈસાહેબ અને કાઈદજોહર ભાઈસાહેબ - એક વર્ષ પહેલાં નસ જાહેર કરી ત્યારે એસ.કે.ક્યું ને સાંભળ્યા હોત. તેઓએ પત્ર લખી આમજ જણાવ્યું હતું – જેની તેઓએ સંપૂર્ણપણે અવગણના કરી. એસ.કે.ક્યું તેમણા સાથે વાત કરવાનું આમંત્રણ પણ આપ્યું – જે આમંત્રણની તેઓ એ ઠેકડી ઉડાવી! કોઈએ પણ અદાલત કે વકીલો ઉપર એક રૂપિયો પણ ખર્ચ કર્યા વગર શાંતિપૂર્ણ અને સરળ સંક્રમણ થઈ શક્યું હોત.

સ.૧૩ અપને આ “બાદશાહી” કુટુંબની વંસવેલી બનાવી શકો? હું કસરે-આલીથી શરૂઆત કરીશ જેના મુખીયા સૈયદના તાહેર સૈફુદ્દીન, ૫૧માં દાઈ. કસરે-આલી બેતે-જઈની ના મોટા જૂથ નો એક ભાગ છે અને સામાન્ય રીતે તેના જુના નામ કોથાર તરીકે ઓળખાય છે.

જ.૧૩ સૈયદના તાહેર સૈફુદ્દીનના પિતા સૈયદના મોહંમદ બુરહાનુદ્દીન (૪૯ માં દાઈ) અને તેમના પિતા સૈયદના અબ્દુલકાદર નજમુદ્દીન (૪૭ માં દાઈ) અને તેમના પિતા સૈયદના તૈયબ નજમુદ્દીન હતા..

સ.૧૪ સૈયદના તાહેર સૈફુદ્દીનના ૫ બૈરા હતા. તેમની ઇચ્છા વિરુદ્ધ તેમના પહેલા બૈરો સાથે શાદી કરવા દબાણ કરવામાં આવેલું. આ મહિલા એક અગ્રણી કુટુંબના હતાં અને બાલ્ય અવસ્થામાંજ શાદી કરવામાં આવેલી. આ મહિલાની ખૂંધવધવા લાગેલી. કોઈ આ

મહિલા નું નામ જાણે છે, અને ક્યાં કુટુંબ માંથી તેઓ હતા?

જ.૧૪ હાં, હુસેના આઇસાહેબા સૈયદના મોહંમદ બુરહાનુદ્દીન,અસમા બેનસાહેબા અને હુસૈન ભાઇસાહેબના માં હતાં. જ્યાં સુધી સૈયદના તાહેર સૈફુદ્દીનના બીજા બૈરોની વાત છે, આ મે પહેલી વાર સાંભળ્યું છે તેથી તેનું સમ્રથણ હું કરી શકું નહિં.

સ.૧૫ સૈયદના તાહેર સૈફુદ્દીનના ત્રીજા બૈરો વજીરા આઇસાહેબા સૈયદના તાહેર સૈફુદ્દીનના માનીતા નહોતા. મેં સાંભળ્યું છે કે તેઓ સુરતમાંજ રહેતા અને તેમના પતિ સાથે મુંબઇમાં રહ્યાં નથી. તેઓ તેમના મોટા ભાઇનાં વિધવા હતાં, જેઓ ઉપર નસ થઇ હતી પરંતુ દાઇ બનવા પહેલા ગુજરી ગયાં હતા. સૈયદના તાહેર સૈફુદ્દીનને મરહૂમના વારસામાં દાઇનો હોદ્દો મલ્યો અને મરહૂમની વિધવા સાથે જબરદસ્તીથી શાદી કરવાનું દબાણ થયું, જે તેઓ એ અનિચ્છાએ સ્વિકાર્યું. વધારેમાં તેમના ૨ દીકરાઓ ને આમીલ તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ મોકલી દેવામાં આવ્યાં. તેમના બાળકો હજુ લોસ એન્જલસ અને ન્યુજર્સી માં આમીલ તરીકે સેવા આપી રહ્યાં છે. (દીકરાઓ કાસીમ અને અસગર અને દીકરીઓ મારીયા, ખદીજા અને બાનુ)

જ.૧૫ વજીરા આઇસાહેબાના પહેલા લગ્ન એસ.ટી.એસ.ના મોટા ભાઇ સૈયદી તૈયબ ભાઇસાહેબ ઝૈનુદ્દીન(સૈયદના તૈયબ ભાઇસાહેબ ઝૈનુદ્દીન નહિં) સાથે થયેલાં. તેમણા ગુજરી ગયા પછી, વજીરા આઇસાહેબાએ સૈયદના તાહેર સૈફુદ્દીન સાથે લગ્ન કર્યાં,તેમના ૨ પુત્રો હતાં, જે મે અગાઉના એક લખાણમાં લખ્યું છે. તેઓ સુરતમાં રહેતાં નોહતા – તેઓ સૈફીમહેલમાં રહેતાં, પહેલા માલે (ગ્રાઉન્ડ ફ્લોર) અબ્દુલતૈયબ ભાઇસાહેબ ઝકીઉદ્દીનના પડોસમાં(એસ.ટી.એસ.ના દીકરા, ભાઇ નહિં) વજીરા અઇસાહેબાના પહેલાંના દીકરા દાઇકાઓ સુધી પુનામાં આમીલ રહ્યાં, તેમનું છેલ્લું નામ પણ ઝૈનુદ્દીન હતું, અને તેમના કેટલાક દીકરાઓમાં ડો.ઇદરીસ ભાઇસાહેબ ઝૈનુદ્દીન સહેરેબાનુ બેનસાહેબા ને પરણેલા (એસ.ટી.એસ.ના દીકરી) અને તેઓ લંડનમાં ઘણા દાઇકા સુધી હતાં. બીજા દીકરાઓ અલીઅસગર, નોમાન અને નજમ સાન ફાન્સિસ્કોના બે વિસ્તારમાં ઘણાં વરસો સુધી હતાં, પરંતુ હાલમાં તેમાંથી કોઇ પણ યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતું નથી. વજીરા આઇસાહેબાને મારી જાણકારી મુજબ કોઇ દીકરી નહોતી. તમેજે નામ લખ્યાં છે તે ફાતેમા આઇસાહેબાની દીકરીઓ છે. કાસીમ અને અલીઅસગર જે નામ તમે લખ્યા છે તે પણ ફાતેમા આઇસાહેબાના દીકરાઓ છે.

સ.૧૬ સૈયદના તાહેર સૈફુદ્દીનના છેલ્લી ૨ પત્નીઓ તેમને વધુ વહાલી હતી.

જ.૧૬ કદાચ હોઈ શકે..

સ.૧૭ ચૌથા પત્ની આમેના આઈસાહેબા. તેઓ હાલ માઝુન, ખોઝેમા કુંટબુદીનના માં છે. બધાં મલીને તેમને સૈયદનાને માઝુનના સાથે ૫ દીકરાઓ આપ્યાં અને ૪ દીકરીઓ. એમાં એક દીકરા હાતીમ હકીમુદ્દીન હતા, જે ઓક્સફર્ડ વિદ્યાન તરીકે વોહરાઓ વચ્ચે પ્રસિદ્ધ હતાં

જ.૧૭ હું બહાલી આપુ છું. હાં.

સ.૧૮ પાંચમાં બૈરો ફાતેમા આઈસાહેબા, સુપ્રસિદ્ધ યુસુફ નજમુદ્દીનનાં માં. તેનીએ સૈયદનાને વા.ય.એન. સાથે ૩ દીકરાઓ અને ૩ દીકરી આપ્યાં. વા.ય.એન.તેના પિતા સૈયદના તાહેર સૈફુદ્દીન થી જકાતના બદલે વાજેબાતના અમલીકરણ ઉપર ખફા હતા.એમને તક મળી સૈયદના મોહમદ બુરહાનુદ્દીનના સમય માં, અને વેર સાથે તે અમલમાં લાવ્યાં. આસુરાનો વાર્ષિક હંગામો દુનીયાની અલગ અલગ જગ્યાં ઉપર યોજવાનું મુખ્ય ભેજુ પણ તેમનુંજ હતું.

જ.૧૮ હાં હુ બહાલી આપુ છું, પણ વાજેબાત બાબત નહિ.

સ.૧૯ અંતમા,સૈયદના તાહેર સૈફુદ્દીનના ૨૩ બાળકો હતા. તેમના પરિવારો હવે વિસ્તરીને લગભગ ૨૦૦ સભ્યોનો સમાવેશ થાય છે.

જ.૧૯ ૨૧ બાળકો (જુઓ મારા પહેલાંનાં લેખો). સકીના બેનસાહેબા ખૂબ જ નાની વયે ગુજરી ગયાં.તેઓ ફાતેમા આઈસાહેબાના સૌથી મોટા દીકરી હતા અને તેમની ઝીયારત ચરનીરોડ, મુંબઈ માં છે.લગભગ કસરે-આલીનાં ૩૫૦ સભ્યો હાલમાં છે.

સ.૨૦ હુંસૈના આઈસાહેબાના પિતાને “મુદ્દઈ” જાહેર કરવામાં આવેલાં. હુંસૈના આઈસાહેબાને તેમણા કુટુંબ સાથેના તમામ સંબંધો તોડી નાખવાની ફરજ પાડવામાં આવી હતી, ખાસ કરીને તેમના ભાઈ ઇસ્માઈલ, તેમણો ભાણો, ઇસ્માઈલ ના દીકરા, એહમદ લુકમાની સાથે. જેઓ ૨ વરસ પહેલા ગુજરી ગયા ત્યાં સુધી યુનાઇટેડ કિંગડમ માં પ્રોગ્રેસિવ બોહરા જમાતનું સંચાલન કરતા હતા.

જ.૨૦ આ હું પ્રથમ વાર સાંભળુ છું, તેથી આને હું બહાલી આપી શકુ નહિ.

સ.૨૧ સૈફીમહેલમાં એક અફવા હતી કે સૈયદના તાહેર સૈફુદ્દીનના પત્નીઓના કાવતરાને કારણે હુસૈના આઇસાહેબાને ઝેર આપવામાં આવેલું અને તેથી તેઓ ગુજરી ગયાં. સૈયદના એમના આ પત્ની સાથે – તેમને વધું વહાલા હતા - વધુ પડતો સમય વીતાવતા તે કારણે પત્નીઓ માં રોષ હતો.

જ.૨૧ હુસૈના આઇસાહેબાના ગુજરી ગયા પછીજ સૈયદના તાહેર સૈફુદ્દીનએ બીજી ૩ પત્નીઓ સાથે લગ્ન કર્યાં તેથી સિદ્ધાંતીક અર્થમાં પ્રથમ વાક્ય માં કોઈ વજુદ નથી. હાં, આમેના આઇસાહેબા, ચાર આઇસાહેબાઓ માં સૌથી યુવાન આઇસાહેબા છેલ્લા વરસોમાં એસ.ટી.એસ.ની ખીદમતમાં હતાં. હું રોષની વાતને બહાલી આપી શકુ નહિ.

સ.૨૨ કેટલાક પ્રશ્નોના ઉત્તર ની તમારી પાસે જાણકારી નથી કે તમે બહાલી નથી આપી શકતા?

જ.૨૨ જે વિષય/ચર્ચા વિષે મારી પાસે જાણકારી ન હોય તેની બહાલી હું આપી ન શકું. હું કઈ ઉપજાવતો નથી, માફ કરજો. 😊 કોઈએ પણ જાણતા ન હોય તો બહાલી આપવી ન જોઈએ.

સ.૨૩ એસ.એમ.બી.એ ફાતેમા ઝેહરાની જરી બનાવવા માટે સોનાનુ ઉઘરાણું કર્યું, અને એમ.એસ. પણ તેમજ કરે છે. તે સોનુ ક્યાં છે, અથવા પહેલેથી રફેદફે થઈ ગયું છે?

જ.૨૩ એસ.એમ.બી.એ તે ક્યારે નથી કર્યું, તે તેમના શેહઝાદા હતાં, કદાચ શેહઝાદાના સાચા અને ખુદામાં આસ્થા ધરાવનાર મદદનીશો માંથી કોઈ એક આની પુષ્ટિ આપી શકે. (સુભેચ્છા તેમને શોધવા માટે)

સ.૨૪ જીઆફતના રૂપિયા કેવી રીતે વહેંચાય છે?

જ.૨૪ કોથાર તેની કાલજી લે છે. તેનો અર્થ કે અસલ કોથાર –કસરે-આલી માંથી નહિં એવા ખીદમતમાં રહેલા જામીયાની પદવી ધરાવતા. વિતરણ વિશે, તમારુ અનુમાન એજ

મારું અનુમાન છે.

સ.૨૫ અલગ અલગ મઝારના ગલ્લા માંથી નિકલતા રૂપિયા કોણે જાય છે.

જ.૨૫ તેની પણ કોથાર જ કાલજી લે છે. પરંતુ મને માત્ર કહેવા દો કે ગલ્લા ખાસ કરીને ભારતમાં ઘણી ધાર્મિક જગ્યાં ઉપર જોવા મળે છે અને શ્રદ્ધાલુઓ આ પૈસાનું શું થાય છે એ વિષે પ્રશ્ન નથી કરતા, એજ અપણી પણ શ્રદ્ધા છે નહિંતર, શા માટે ગલ્લામાં કંઈપણ મૂકવાની કડાફ્ટ કરીએ, બરોબર?

સ.૨૬ દાવતનો નાણાકીય હિસાબ શામાટે બહાર નથી આવતો. કોણ એણે અતિશય જકડિને રાખે છે

જ.૨૬ તમે ખરેખર વિચારો છો કે કોઈ નાણાકીય હિસાબ છે? મુફદલ ભાઈસાહેબને બચત અને હિસાબની ચકાસણી વચ્ચેના તફાવતની ખબર જ નથી. કોણ એના માટે પુછશે? જે નાણાકીય બાબત સંભાલે છે તે? 😊

સ.૨૭ શું સાહેબ-એ-દાવત, દાવત ને પૈસા ચુકવી દે છે / જમા કરાવે છે, કે પછી તે તેની વ્યક્તિગત મિલકત થઈ જાય છે? એસ.ઈ.ડી. ની પસંદગી માટે માપદંડ શું છે

જ.૨૭ મને ખબર નથી તે લોકો પૈસાનું શું કરે છે, તેથી હું બહાલી આપી ન શકું. છતાં પણ, અગર તે લોકો નજરૂલ મુકામ જેવી રકમ વસૂલે છે તો તે દાવતમાં અસલી જગાએ જાય છે – યા જવી જોઈએ. પસંદગી માટે માપદંડનો આધાર તમે મુફદલ ભાઈસાહેબને, શાહઝાદાઓને અને કોથારને કેટલા પસંદ છો એના ઉપર છે. તે ચોક્કસપણે તમારા કામકાજના સારાંશ પર આધારિત નથી!

સ.૨૮ શું એ સાચું છે કે સ્થાનિક જમાતોના આમીલને વાજેબાત ઉઘરાવવા માંટે એક લક્ષ આપવામાં આવે છે અને તેઓને ઉઘરાવેલી રકમ ઉપર દલાલી મળે છે? આ ઉપરાંત શું તમે કહી શકશો કે શું એ સત્ય છે કે સૈફીમહેલમાં જે લોકો જેવાકે હિસાબનીસ, ડ્રાઈવર, રક્ષકો મુમેનીન નથી હોતા અને કસરે-આલી ઇરાદાપૂર્વક મુમેનીન/મુમેનાત ને રાખતા નથી?

જ.૨૮ (૧) તેઓને દલાલી મલતી નથી.

(૨) હાં, તેઓ મુમેનીન નથી. ઘણા બધા બીહારી મુસલમાન છે.એ લોકોનું રહેવાનું સ્થાન સારું નથી અને હું મુમેનીન માટે ભલામણ ન કરી શકું.

સ.૨૯ ડો. ઇદરીસ ભાઇસાહેબ જૈનુદીન એ શહેરેબાનુ સાથે શાદી કરી (એસ.ટી.એસ. ના દીકરી) અને તેઓ લંડનમાં દાયકાઓ સુધી રહ્યાં.

શું આ એજ ડો. ઇદરીસ છે જેને દારૂ પીને કાર ચલાવતા કોઇકને પ્રાણઘાતક રીતે કચડી નાખ્યાં હતાં એમ કહેવાય છે કે તેને જેલ માથી બહાર કાઢવા કોથારે કરોડો ખર્ચેલા?

જ.૨૯ તેઓ પીધેલા નહોતા. હાં, તેઓજ છે.

સ.૩૦ મારા પાસે અમારા જેવા સામાન્ય માણસો માટે તમારા માટે થોડા સવાલો છે સૈફીમહેલમાં શું થઇ રહ્યું તે સમજવાં માટે.

૧. યુસુફ ભાઇસાહેબનું મૃત્યુ. સામાન્ય મુમેનીનને કહેવામાં આવ્યું કે તેઓનું મરણ મોટા હૃદયરોગના હુમલો થી થયું છે પરંતુ આ જાહેર ચર્ચામાં પ્રગટ થયું છે કે તેઓનું ઇજીપ્તના માફીયાઓ એ ખુન કર્યું હતું – એક કેઇરોની હોટેલના વરંડામાંથી ફેંકીદેવાથી થયું હતું. સૈફીમહેલના અંદરના સમાચાર શું હતા જ્યારે તેઓનું મરણ થયું? શું તેઓ જાણતા હતાં કે ખરેખર તેમનું મરણ કેવી રીતે થયું હતું?

જ.૩૦ હાં, તેઓ જાણતા હતા કે તેઓ નું ખરેખર મૃત્યુ થયું છે અને તે હૃદયરોગનો હુમલો હતો એમ જણાવ્યું હતું.

સ.૩૧ ભૂતપૂર્વ માઝુનએ જાહેર કર્યું હતું કે તેની સામે ૩ હત્યાના નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યા હતા. તમે જાણો છો આ ક્યારે અને કોણે કર્યું હતું?

જ.૩૧ મને તેની કોઇ જાણકારી નથી.

સ.૩૨ શું એ સાચું છે કે સૈફીમહેલ ખરેખર માઝુનના નામ ઉપર છે – આ એસ.ટી.એસ એ તેમને તોહફામાં આપી હતી?

- જ.૩૨ સૈફીમહલ - ઇમારતજ - દાવતની માલીકીની છે. બીજી ૨ ઇમારતો અલ-અઝર અને બુરહાની મંઝીલ ખાનગી માલિકી ધરાવે છે
- સ.૩૩ કોઈપણ ભાઈબહેનો હતા જે છેલ્લા વર્ષ સુધી - ભાગલા પડ્યાં ત્યાં સુધી ભૂતપૂર્વ માઝુનના નજીક હતા, અથવા ઘણા વર્ષો પહેલા ઇસ્ટ આફ્રીકાના બનાવ પછી ભાઈબહેનોએ તેમના સાથે સંબંધો કાપી નાખ્યાં હતા?
- જ.૩૩ સંબંધો ક્યારે પણ સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવ્યાં ન્હોતા. કેટલાકનો સંપર્ક હજુ પણ છે, પરંતુ જાહેરમાં નહિં.
- સ.૩૪ એ એસ.એમ.બી હતા જેઓએ સોનાનું ઉધરાણું શરૂ કરેલું, તેઓએ વાએઝમાં દાનમાં આપવા કહેલું, હોઈ શકે કે તેમના પુત્રો ઉધરાનાનું ધ્યાન રાખતા હોઈ. આ વિશાળ સોનાનો જથ્થો કઈ પટલી હવામાં અદૃશ્ય થઈ ન શકે. તમે કસરે-આલીના આંતરિક વર્તુળ અને કસરે-બુરહાની ના કામકાજ વિશે જાણો છો તેથી ફરી કૃપા કરીને તપાસ કરશો?
- જ.૩૪ મને આ વિશે કોઈ જાણકારી નથી. કાઇદજોહર ભાઈસાહેબના દીકરાના આ બધું સંભાલે છે.
- સ.૩૫ મને જ્યાં સુધી ખબર છે, જીયાફતના પૈસા સેયદના તરફથી પુરા કસરે-આલી અને કોથારને વહેંચવામાં આવતા. દરેકે દરેકને તેમના હોદ્દા પ્રમાણે કવર મલતુ ૫૦૦૦૦ રૂપીયા થી ૫૦ રૂપીયા સુધી. કદાચ જૂના અને દૂરનાં સંબંધીઓને હવે નહિં આપવામાં આવતા હોઈ અથવા તો જેઓના એસ.એમ.બીના દીકરાઓના સંબંધ સારા ન હોઈ. પણ બોણી તો વહેંચાય છે.
- જ.૩૫ હાં, બધાંને કવર મળે છે પરંતુ સૈયદના ને જે મળે છે તેનું શું થાય છે તેની મને ખબર નથી.
- સ.૩૬ કેવી રીતે એસ.ટી.એસ. અને એસ.એમ.બી. નું વિસ્તારિત કુટુંબ ગુજરાણ ચલાવે છે અગર તેઓ અમાલત ઉપર ન હોઈ અથવા મોટી ઉંમરના હોઈ.

- જ.૩૬ હાં હાં, તમે ત્રણ આંગળીઓ થી આ ગણતરી કરી શકો છો. આ ત્રણ પરિવારો એસ.કે.ક્યું સાથે છે અને નોકરી / બિઝનેસ ધરાવે છે.
- સ.૩૭ આ ૩ કુટુંબ કોણ છે, એસ.કે.ક્યું ના પુત્રો સિવાય? કેવી રીતે તેઓ એસ.એમ.બી. અથવા એસ.ટી.એસ. સાથે સંબંધિત છે.
- જ.૩૭ ડૉ. મોહઝ મોહ્યુદ્દીન પેન્સિલવેનિયા, તેમની પુત્રી અને તૈઝુન શાકિર .
- સ.૩૮ હોઈ શકે છે કે એમ.એસને નાણાકીય બાબતનો સમજ ન હોઈ, પરંતુ આટલું વિશાળ સામ્રાજ્ય યોગ્ય નાણાકીય જાળવણી વગર કામ કરી શકાતું નથી. રસીદ અને સંપત્તિના વિતરણની નોંધતો થવીજ જોઈએ..અગર નથી તો વાજેબાત ઉંઘરાવવાનું લક્ષ્ય તેઓ કેમ નક્કી કરે છે?
- જ.૩૮ મને કલ્પના નથી.
- સ.૩૯ કસરે-અલીની અંદાજિત સંપત્તિ કેટલી હશે.
- જ.૩૯ મને ખબર નથી. દરેક કુટુંબનું અલગ છે, તેઓએ કેવી રીતે રોકાણ કર્યું છે તેના ઉપર આધાર છે. (જુઓ મારો પહેલાનો લેખ ઇબ્રાહીમ ભાઈસાહેબ અને રોકાણ.)
- સ.૪૦ થીક છે, તે બધામાં સૌથી વધું ધનવાન કોણ છે.
- જ.૪૦ તમારું અનુમાન એજ મારું અનુમાન છે.
- સ.૪૧ હોઈ શકે કે તેઓ પાછા જમા કરતા હોઈ અને ટકાવારી મેલવતા હોઈ. તમે ઉલ્લેખ કર્યો છે કે નઝરુલ મકામ પાછા જમા થાય છે જેની તમે પુષ્ટિ કરી શકો.
- જ.૪૧ ના, મને ખબર નથી તેનું શું થાય છે.
- સ.૪૨ અમે એમ પણ અફવાઓ સાંભળી છે કે ભૂતપૂર્વ માઝુન મૌલા ના માતા ને તાહેર સૈફુદ્દીન મૌલાએ એક હાથથી લખેલ પત્ર આપી વચન આપેલું કે ભૂતપૂર્વ માઝુન

મૌલાને બુરહાનુદ્દીના બાદદાઇ બનાવવામાં આવશે. આવો કોઇ પત્ર અસ્તિત્વમાં છે કે પછી દંતકથા છે?

જ.૪૨ મને આ બાબતની કોઇ ખબર નથી.

સ.૪૩ એસ.એમ.બી.એ શામાટે કે.ક્યું ને દાઇ તરીકે ઘોષિત ન કર્યા જ્યારે તેમના પાસે સમય હતો. તેઓને કોણો દર હતો. શું દાવત તેમના પગ હેઠળથી સરકી ગય હતી?

જ.૪૩ તેઓએ જે કરવાનું હતું તે કર્યું. કારણકે તેઓ પરિચિત હતા કે જો પોતાના જીવનકાળ દરમિયાન જાહેર કરશે તો શું થશે. મને લાગે છે જેઓ એસ.એમ.બી.ને યાહે છે તેમને આ બાબતમાં કોઇ સમસ્યા હોવી ન જોઇએ પણ જેઓ તેમને નથી માનતા તેમને હશે. – અંતમાં - આ એક આસ્થાનો સવાલ છે. મે મારા જ્ઞાન પ્રમાણે તમારા બધા પ્રશ્નોનોના શ્રેષ્ઠ જવાબ આપવા માટે પ્રયાસ કર્યો છે. હું કઇ બધી ગુપ્ત વાતોનો જાણનાર નથી.- કોઇ પણ નથી. ખીદમત કરતા દરેક જણ નિશ્ચિત પાસાઓ સંભાળે છે. તો જ્યાં સુધી તમે કોઇ એસ.એમ.બી.ના શાહઝાદાને અહિં ચર્ચામાં તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે લાવી શકો તોજ તમારા બધા પ્રશ્નોના જવાબ મળી શકે.

સ.૪૪ અમે સાંભળ્યું છે કે આફ્રિકા માં કે.ક્યું.એ સી.ડી. અથવા કાગજો વહેંચેલાં અને એમ દાવો કરીને બધાની સહી લીધેલી કે પોટાને પણ ઇમામનો ફેઝ મળે છે. આ સાચુ છે? શા માટે એમએસ તરફથી આવા પ્રકારના આરોપો ના ઘા કરવામાં આવે છે ત્યારે કે.ક્યું દ્વારા કઇ કેહેવામાં આવતુ નથી?

જ.૪૪ કારણ કે આ સાચું નથી – કોઇને પણ કહેવામાં આવ્યું નોહતુ કે ઇમામનો ફેઝ મળે છે એમ કહીને સહી કરો. જો કે, સહીઓ બુરહાનુદ્દી મૌલાના વફાત બાદ ઇદરીસ ભાઇસાહેબે તેમના રોજિંદા એક બેઠકમાં લીધી હતી. તેઓએ સૈફીમહલમાં બધાની - કોરા કાગળ ઉપર - સહી લીધી હતી અને તેઓએ કહ્યું હતુ કે આ ભારતમાં સ્થાનીક અધિકારીઓને જાશે.

સ.૪૫ અમને ખેદ છે,જો તમને લાગતું હોઇ કે અમે બધા તમને ઘેરી રહ્યાં છીએ. પણ મહેરબાની કરીને સમજો કે દાઇ અને તેના અનુયાયીઓ વચ્ચે એટલી બધી દુરી છે કે, કોઇ લોકોના પ્રતિનિધિ હોવાનો દાવો કરે અને લોકો સવાલ પુછવાનું તો થીક તેની

તરફ પહોંચવાનો માર્ગ પણ ન હોય તેને આવા સવાલોનો સામનો કરવોજ રહ્યો.
કૃપયા પ્રશ્નો ના સ્વરની અવગણા કરીને તમે આપી શકો એટલી વાસ્તવિક માહિતી
આપો કે જેથી કોથારે અને બોહરા નેતાઓએ હંમેશ માટે વિશ્વાસ ગુમાવ્યો છે તે તમે
જીતી શકો.

જ.૪૫ ચિંતા કરશો નહીં. આ જરાએ ઘેરાવો નથી. હું ઇચ્છું છું કે લોકો જે વિશે પૂછે છે તે બધી
માહિતી મારી પાસે હોત. પરંતુ બધા પાસે બધી માહિતી હોતી નથી. જો કે, હું તમને
એવું કંઈ નહીં કહું જે મને ખબર નથી. અમિરૂલ મુમેનીન સ.અ કહે છે કે જો તમે કશુંક
નથી જાણતા, તો કહો કે તમે નથી જાણતા.

સ.૪૬ મને સ્પષ્ટ પણે યાદ છે કે એસ.એમ.બીની આફ્રિકા સફરની ઓડિયો રિલે તેમના
વફાત બાદ ૪૦ દિવસો દરમિયાન એક દિવસે આખી દુનિયામાં સંભળાવવામાં
આવેલી. મે પોતે પણ તે સાંભળેલી હતી. એમા તેઓ કહે છે કે (ચોક્કસ શબ્દો મને
યાદ નથી) ઇમામનું ફેઇઝ ફક્ત દાઇનેજ આવે અને દાઇથી બીજાને જાઇ. કોઇ અન્યથા
દાવો કરે તે સાચા રસ્તા પર નથી. આ કોઇ એટલે કોણ સંદર્ભમાં તેઓ કહે છે?
એમ.એસ. તરફથી દાવો છે કે આ કે.ક્યું છે. કૃપયા તમારો અભિપ્રાય શું છે.

જ.૪૬ હાં, મે પણ આ વીડીઓ જોઇ છે. અને હેબતુલ્લાઓ આખી દુનિયામાં બોલીવુડની
બ્લોકબસ્ટર ની જેમ બતાવે છે. હેબતુલ્લા કંઈ કહે છે અને એસ.એમ.બી કંઈ બીજું કહે
છે. અપને પહેલાથી સાબિતી પ્રાપ્ત થઇ છે કે રોઝત તાહેરાની વિડિઓ પાછલ મુખ્ય
ભેજુ ડો મોઇઝ, શાહઝાદાઓ અને તોળીઓ નું હતું. શુ વધુ સાબિતી લોકોને જોઇએ છે?
! જાગો અને સચને પારખો. શા માટે આ કોમ આટલી મૂર્ખ છે?!

સ.૪૭ તમે અને મારા સહિત ઘણાને બુરહાનુદ્દીન મૌલાના માટે ઘણો આદર છે. પરંતુ શામાટે
તેઓએ કોઇ બયાન જારી ન કર્યું જ્યારે તૈઝુનભાઇ શાકીરને મુંબઇમાં માર મારવામાં
આવ્યો? શાંમાટે તેઓ શાંત રહ્યાં જ્યાંરે અસગરઅલી ઇન્જીનીયર ઉપર ખોટી તહોમત
મુકવામાં આવી અને તેની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી? શા માટે મૌલા ઉદયપુર
મસ્જિમાં પ્રગતિશીલ સ્ત્રીઓને મારવામાં અને અપમાનીત કરવામાં આવી તે વિશે કશું
કહ્યું ન હતું. તમે જાણો છો કે સૈફીમહેલમાંથી આ જંગલીપણું અને હિંસા ના કૃત્યો માટે
જવાબદાર કોણ હતું?

જ.૪૭ તમે ખરેખર માણો છો કે મહાન શાહઝાદાઓ એ વાસ્તવમાં એસ.એમ.બી ને કહ્યું હશે કે તૈઝુનને મારવામાં આવ્યો છે, અથવાતો બીજાઓને મારવામાં આવ્યાં છે?! અલબત્ત નહિં!

શાહઝાદાઓ એસ.એમ.બી ને શું બતાવવા માંગે છે તેજ બતાવે છે. શા માટે તમને લાગે છે કે તેઓ દાવત આખીને લઈને ભાગી છુટવામાં કામચાબ થયા?!

સ.૪૮ તો પછી તમે સહમત થશો કે દાદ “ગેંઘબ ના જાણકાર” નથી?

જ.૪૮ ફાતેમી માન્યતા અનુસાર, અને એસ.ટી.એસ. આ ઘણી વખત સ્પષ્ટપણે કહેતા, દાદ એટલું દુર સુધી જોઈ શકે છે જેટલું ઇમામુઝ ઝમાન તેમને દેખાડવા ચાહતા હોઈ. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ માનવ સ્વરૂપમાં છે અને તેથી તેઓ માનવીય રીતે મર્યાદિત છે જ્યાં સુધી દેવી શક્તિ દરમિયાનગીરી કરે. રસુલુલ્લાહ સ.અ.વા.ના મોજુજા પણ આમજ હતા.

સ.૪૯ શાહઝાદા અને શાહઝાદીઓ કોઈપણ સામાન્ય માનવીઓ સાથે લગ્ન કર્યા છે. અને હાં તો કોણ?

જ.૪૯ હાં, એવા ઘણા કમ છે.

સામાન્ય માનવીઓ સાથે લગ્ન

સામાન્ય માનવીઓમાં કસરે-આલી (એસ.ટી.એસ.ના ફરઝંદો) અને બૈતે-ઝૈની નો સમાવેશ થાય છે.

એસ.ટી.એસ.ના શાહઝાદા

હુસેન ભા.સા.હુસામુદ્દીન - સામાન્ય માનવી સાથે લગ્ન - બીજા બૈરો - મૈમુન બા.સા.

અબ્દુલતૈયબ ભા.સા.ઝાકીયુદ્દીન - સામાન્ય માનવી સાથે લગ્ન - બીજા બૈરો -

બીલકીસ બા.સા.

કાસીમ ભા.સા.હઅકામુદ્દીન- સામાન્ય માનવી સાથે લગ્ન - ફીઝ્ઝા બા.સા.

શબ્બીર ભા.સા. નુરુદ્દીન- સામાન્ય માનવી સાથે લગ્ન - હુસૈના બા.સા.

અબ્બાસ ભા.સા.ફખરુદ્દીન- સામાન્ય માનવી સાથે લગ્ન - રશીદા બા.સા.

એસ.એમ.બી.ના શાહઝાદા

મલેઇકુલ અસતાર ભા.સા. સુજઉદ્દીન - સામાન્ય માનવી સાથે લગ્ન -તસનીમ બા.સા.
હુઝેફા ભા.સા. મોઇયુદ્દીન - સામાન્ય માનવી સાથે લગ્ન - નફીસા બા.સા.

સ.૫૦ એ શાહઝાદાઓ જેઓ આગેવાની માટે કાર્યક્ષમ છે તેઓના લગ્ન ગોઠવવાનું કારણ એક અર્થમાં વારસદારો ને દોરવવાનું છે?

જ.૫૦ શક્ય છે નાણાકીય લાભ માટે, જેમ ઘણા ભારતીય લગ્ન ગોઠવાય છે.

સ.૫૧ શિક્ષણ ની દૃષ્ટિ થી શાહઝાદાઓ ને સંપૂર્ણ ધર્મશાસ્ત્ર નું જ્ઞાન આપવામાં આવે છે અને સામાન્ય માનવીઓ જે જામીયામાં ભણે છે તેનાથી અલગ અને ચડિયાતું થવાના પ્રયાસ રૂપ?

જ.૫૧ તે અલગ નથી, તે ઉચ્ચતર છે. તેમાં પુસ્તકો ના સ્તરો છે - ઝાહીર, તાવીલ અને હકિકત. ઘણા કમ રૂતબા ધરાવતા હકિકતનાં પુસ્તકો સુધી પહોંચી શકે છે જેવા કે દાઇ અને માઝુન.

સ.૫૨ આ એક એકાધિકાર નેતૃત્વ મેળવવાની ઇરાદાપૂર્વક ની વ્યૂહરચના છે ?

જ.૫૨ ના એવું કંઈ નથી. વધુ પારિવારિકતા પછી અન્ય કંઈપણ અને સુસંગતતા - રોયલ પરંપરાઓ જાણવું.

સ.૫૩ તો સવાલો એ છે:

(૧) શા માટે એસ.એમ.બી. એ જાહેરમાં નસ ના કરી - આ વિજ્ઞાનના જમાનામાં. એ સૌથી આસાન માર્ગ હતો. અને શાંમાટે આ સવાલનો જવાબ હંમેશા હિકમતજ હોઇ છે?

(૨) શા માટે એસ.કે.ક્યું. જ્યારત કરવા ન ગયા? આ હજારો લોકોના દિમાગ પર છે. આના પાછલ હિકમત શું છે?

(૩) કેવી રીતે અપણે જાણી શકીયે કે શરૂઆત કરવા માટે દાઉદી વોહરા જ સાચો પંથ છે? આના પાછલ હિકમત શું છે?

(૪) શા માટે એસ.એમ.બી.ના કોઇ મોજુજા ન થયા - ઘણા આની પ્રતીક્ષામાં છે - તેમનું ભાવિ નક્કી કરવા માટે? આના પાછલ હિકમત શું છે?

(૫) કોર્ટ કેસ પાછળ નું વાસ્તવિક કારણ શું છે - હવેતો એક વરસ થવા આવ્યું. આના પાછલ હિકમત શું છે?

(૬) મને ખબર છે ઘણાના મનમાં આ પ્રશ્નો છે પણ જાહેરમાં પૂછતા ઘણા દરે છે.

જ.૫૩ પરંતુ એક વસ્તુની ખાતરી છે કે - મુફદલ ભા.સા. દાઇ તરીકે - આની પાછલ કોઇ હિકમત નથી. જો એ ખરેખર દાઇ છે તો આ ધરમજ સવાલીયો બની રહે છે. અપને આશા રાખીયે કે સૈફીમહેલ નું ભાવિ અપણા વિશ્વાસ નું ભાવિ નથી.

સ.૫૪ મને પણ એવું જ લાગે છે, અને મને ખાતરી છે કે અન્ય ઘણા લોકો ને પણ. આ સંવેદનશીલ વિષય લાવવું યોગ્ય નહતું પરંતુ સચ્ચાઇ જાણવી જરૂરી છે, એમ આક્ષેપ મુકવામાં આવે છે કે કે.ક્યું એ તે મરસીયા ક્યારે પણ પઢયા ન હોતા. તેથી અહિં કંઇક ચોક્કસપણે શંકાસ્પદ છે.

જ.૫૪ કુલકુલ હુસૈન મરસીયા ઘણી વખત મજલિસ અને વાએઝોમાં સૈયદના કુટુંબીન ત.ઉ.સ.ની અધ્યક્ષતા માં પઢવામાં આવ્યાં છે. કોઇ પણ એ દાવો કરે છે કે આ મરસીયા પઢવામાં આવ્યાં ન હોતા તે હઠહઠનું જુઘાણું છે.